

વારાણસી (બનારસ)
શાંત નિર્મળ ગંગાના તટે,
કેવળજ્ઞાની પાર્શ્વ પરમાત્માના
પરમાણુઓથી વ્યાપ્ત ભૂમિ પર,
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ
શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના

JAIN KRANTI
જૈન ક્રાંતિ

Vol. 11 | Issue 3 | Mumbai | FEBRUARY - 2020 | Price Rs. 5/- | Pages : 32

શ્રીમુખેથી વહી જ્ઞાનગંગા !

જાણે સધ્ધાણે નિક્કંતો
તમેવ અણુપાલિયા ॥

॥ સુત્તા અમુણી, મુણિણો સયા જાગરંતિ ॥

॥ સુત્તા અમુણી,
મુણિણો સયા જાગરંતિ ॥

જાણે સધ્ધાણે નિક્કંતો તમેવ અણુપાલિયા ॥

જાણે સધ્ધાણે નિક્કંતો
તમેવ અણુપાલિયા ॥

॥ સુત્તા અમુણી, મુણિણો સયા જાગરંતિ ॥

॥ સુત્તા અમુણી,
મુણિણો સયા જાગરંતિ ॥

જાણે સધ્ધાણે નિક્કંતો તમેવ અણુપાલિયા ॥

જાણે સધ્ધાણે નિક્કંતો
તમેવ અણુપાલિયા ॥

॥ સુત્તા અમુણી, મુણિણો સયા જાગરંતિ ॥

॥ સુત્તા અમુણી,
મુણિણો સયા જાગરંતિ ॥

જાણે સધ્ધાણે નિક્કંતો તમેવ અણુપાલિયા ॥

જાણે સધ્ધાણે નિક્કંતો
તમેવ અણુપાલિયા ॥

॥ સુત્તા અમુણી, મુણિણો સયા જાગરંતિ ॥

॥ સુત્તા અમુણી,
મુણિણો સયા જાગરંતિ ॥

આજે
'શ્રુત જ્ઞાન'
ભવિષ્યમાં
'કેવળજ્ઞાન'



કાગળની નાવ

કે

લાકડાની નાવ...



નાવ લાકડાની પણ હોય અને નાવ કાગળની પણ હોય. કાગળની નાવ દેખાવમાં સુંદર હોય, આકર્ષક હોય, આંખને ગમી જાય એવી હોય, જ્યારે લાકડાની નાવ એકદમ સાદી હોય, ક્યાંક-ક્યાંક તૂટેલી હોય, ક્યાંક-ક્યાંક ખીલ્લીઓ બહાર નીકળેલી હોય. કાગળની નાવ પોતે તો ડૂબશે પણ બેસનારને પણ ડૂબાડશે, જ્યારે લાકડાની નાવ પોતે તો તરશે અને એમાં બેસનારને પણ તારશે.

લાકડાની નાવ જેવા જે હોય એ જ ગુરુ બની શકે, એમનાં અનુશાસન રૂપી ખીલ્લીઓ ભલે તમને ક્યારેક વાગે પણ ખરી, પણ અંતે તારે પણ એ જ !

તમને કેવા ગુરુ ગમશે ? તમે કેવા ગુરુનો સ્વીકાર કરશો ?

જે તમારા ઈગોને સેટિસ્ફાય કરે એવા ગુરુને સ્વીકારશો કે જે તમારા ઈગોને ઝીરો કરે એવા ગુરુને સ્વીકારશો ?

જે તમને પ્રેમ કરે અને પંપાળે એવા ગુરુ તમને ગમશે કે જે તમારી પ્રજ્ઞાને જાગૃત કરે એવા ગુરુ ગમશે ?

ગુરુ એ જ હોય, જે તમારા પર કઠોર અનુશાસન કરી તમારી પ્રજ્ઞાને જગાડે, તમારી આંતરિક શક્તિઓને ઉદ્દઘાટિત કરે, તમારી અંદરમાં રહેલી તમારી જ સક્ષમતાઓને પ્રગટ કરે અને તમારા આંતરિક ગુણોને બહાર લાવે.

જેમનામાં આવી સક્ષમતા હોય, આવી ગુણ સંપદા હોય, એમનો 'ગુરુ' તરીકે સહજ સ્વીકાર થઈ જ જાય. એ 'ગુરુ' તરીકે સ્વીકાર્ય હોય.


સૌજન્ય : ગુરુભક્ત શ્રી મહેતા પરિવાર- ઘાટકોપર (મુંબઈ)



ગૌતમસ્વામી પ્રભુ મહાવીરના સાંનિધ્યમાં 2 કર્તવ્ય કરતાં...

ખુલ્લી આંખે પ્રભુના અસ્તિત્વ અને પ્રભુના વ્યક્તિત્વનું નિરીક્ષણ કરતાં અને પ્રભુ જેવા બનવા માટેના ભાવોને ઉત્કૃષ્ટ કરતાં, કેમકે, પ્રભુ મહાવીર એમના માટે માત્ર 'પ્રભુ' જ ન હતાં, કલ્યાણ મિત્ર 'ગુરુ' પણ હતાં.

બંધ આંખે ગૌતમસ્વામી ધ્યાન કોષ્ટ બનાવી સતત અને સતત સ્વયંના દોષોનું નિરીક્ષણ કરતાં અને આત્મ ચિંતન કરતાં કે મારામાં હજુ એવા કયા કયા દોષો છે જેના કારણે હજુ મારામાં પ્રભુ જેવા બનવાની પાત્રતા પ્રગટતી નથી અને એના માટે સતત પસ્તાવો કરતાં હતાં.



હું તોવું છું કરું...

જેથી મારા પ્રભુ, મારા ગુરુ ભગવાન મહાવીર જે કરે છે,
તે હું કરી શકું, જેથી ભવોભવ જ્યાં મારા 'ગુરુ' હોય ત્યાં હું રહી શકું !

આ અંકમાં
ખાસ વાંચો

આત્મચિંતનની અમૃતધારા

18

હે પ્રભુ!
તારું સમ્યક્ત્વ
પામવું મારે

20

પુરુષાર્થ
મારી ફરજ
ફળ
નિયતીનો ખેલ

22

કાર્યક્ષમતા
વધારવાની
માસ્ટર કી
'પોઝિટીવીટી'

24

શ્રેષ્ઠ સંયોગોની
ઉપેક્ષા

: SUBSCRIPTION :

LIFE TIME (WITHIN INDIA) : ₹ 2500
FOR 2 YRS. (WITHIN INDIA) : ₹ 500
LIFETIME (INTERNATIONAL) : ₹ 20000
FOR 1 YR. (INTERNATIONAL) : ₹ 2500

JAIN KRANTI
જૈન ક્રાંતિ

5th FEBRUARY 2020, YEAR: 20, ISSUE - 232

PAGES : 28 + 4 • RETAIL PRICE : ₹ 5

જૈઓ સહકાર આપી ધન્ય બન્યા તે શુભદાતાના નામ

- * શ્રી ગુણવંતરાય ઝોંસા (સાયન)
- * શ્રી સ્વપનીલ શાહ (ઘાટકોપર)
- * શ્રી કલ્પનાબેન ગીરીશભાઈ દેસાઈ (પાર્લા)
- * શ્રી હીનાબેન સંજયભાઈ શાહ (વડોદરા)
- * શ્રી માલતીબેન હર્ષદભાઈ દોશી (કાંદિવલી)
- * શ્રી હેત-ત્વીશા સંજયભાઈ સંઘવી (ઘાટકોપર)
- * મેટલ પરફોરેશન (પ્રા.) લિમીટેડ (વડોદરા)
- * શ્રી પ્રીતિબેન પ્રવિણચંદ્ર બાવીસી (કાંદિવલી)
- * શ્રી સોહમ મહિલા મંડળ (પાવનધામ-કાંદિવલી)
- * શ્રી દેવીબેન હસુભાઈ શાહ (સાંતાક્રુઝ)
- * શ્રી ભારતીબેન ભરતભાઈ પંચમીયા (ઈન્દોર)
- * શ્રી હેમલતાબેન મણિયાર (વડોદરા)
- * દક્તરી શ્રી રમેશભાઈ પી. (મુંબઈ)
- * વી.સી.કે. ફોરેક્સ (કોલકાતા)
- * શ્રી પ્રદીપભાઈ પી. દોશી (પાર્લા)
- * ઇગલ મેન્યુફેક્ચરિંગ (મુંબઈ)
- * શ્રી લક્ષ્મીકાંતભાઈ જે. શાહ (કાંદિવલી)
- * મહાવીર ટેક્સટાઇલ (કોલકતા)
- * શ્રી કુંદનબેન જયંતિભાઈ સંઘવી (સુરત)
- * શ્રી ન્યાલચંદ મોહનલાલ લાઠિયા (મૂર્તિજાપુરવાળા)
- * માતૃશ્રી અંજવાળીબેન શામળજીભાઈ માલાણી પરિવાર (કોલકાતા)
- * અનશન આરાધક શ્રી રાજેશભાઈ મોદી (ઘાટકોપર)
- * અનશન આરાધિકા શ્રી લલીતાબેન પોપટલાલ હેમાણી (શાહ) (U.S.A)
- * શ્રી ધર્મશભાઈ કામદાર (મુલુંડ)
- * શ્રી મધુબેન છગનલાલ હળવદીયા (ભાયાવદર)

'જૈન ક્રાંતિ'માં આપનું જ્ઞાનદાન એટલે દેશ-વિદેશના હજારો ભાવિકો સુધી પ્રભુનું જ્ઞાન પહોંચાડવાનું ઉત્તમ અનુદાન !

'જૈન-ક્રાંતિ જ્ઞાન દાન' ₹ 11,000=00 એક વર્ષના

CHQ / DD should be in favour of ARHAM YUVA GROUP

આપશ્રીને 'જૈન ક્રાંતિ'ને
અનુદાન આપવું હોય તો
સંપર્ક : +91-9324808181

TO KNOW MORE ABOUT PUJYA GURUDEV CONTACT ON: +91-9860905678

: FORMER EDITOR :
SHREE RASIKBHAI PAREKH

: PUBLISHER :
SHREE DEEPAKBHAI BHAYANI

: EDITOR :
SHREE PRATIMABEN BADANI

: EMAIL :
publication@parasdham.org
website: www.parasdham.org

CONTACT : PARASDHAM
VALLABH BAUG LANE, TILAK ROAD,
GHATKOPAR (E), MUMBAI - 400077
PH: +91-22-25015152

: JOIN US ON :
www.facebook.com/ParasdhamIndia
www.youtube.com/ParasdhamTV

Printed, Published, Edited and Owned by - DEEPAK K. BHAYANI

Printed at Arihant Printing Press: Ghatkopar (E), Mumbai - 400 077 and

Published at: 202, Satellite Building, Opp. Mistry Complex, J. B. Nagar, Andheri (East), Mumbai - 400 099

બનારસના આંગણે શ્રુતજ્ઞાન મહાયજ્ઞ !



મહાનગર કોલકાતામાં જ્ઞાન ગંગામય ચાતુર્માસમાં અનેક આત્માઓના ચૈતન્યને જાગૃત કરી, 3-3 પુણ્યાત્માઓનો દિવ્ય દીક્ષા મહોત્સવ સંપન્ન કરી, 20-20 તીર્થકરોની નિર્વાણભૂમિ શ્રી સમ્મેત શિખરજીની સ્મૃતિયાત્રા કરી, ભગવાન મહાવીર કેવલજ્ઞાન ભૂમિ ઋજુવાલિકા, રાજગૃહી, પાવાપુરી, કુંડલપુર, નાલંદા, બૌધ્ધગયા આદિ ક્ષેત્રોની સ્પર્શના કરી, રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ 41 સંત-સતીજીઓ

સાથે પધાર્યા પરમાત્મા પાર્શ્વનાથની જન્મભૂમિ વારાણસી નગરીમાં !!

બનારસ (વારાણસી)માં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવની પધરામણી થતાં જ બનારસમાં જ્ઞાનની ગંગા વહેવા લાગી. દેશ-પરદેશથી પધારેલાં લુક એન લર્ન જૈન જ્ઞાનધામના દીદીઓની આત્મધ્યાન શિબિર સાથે નિત્ય પ્રવચન, આગમ વાંચના, સત્સંગ અને ભક્તિ આદિમાં જૈન-અજૈન નગરજનો પણ કંઈક નવું અને કંઈક અનોખું જાણવાના ભાવ

સાથે જોડાયાં હતાં.

પરમાત્મા પાર્શ્વનાથના શુભ અને પોઝિટીવ પરમાણુઓથી વ્યાપ્ત વાયુમંડળ સાથે નિર્મળ અને શાંત પવિત્ર ગંગા નદીના તટે, પરમ ગુરુદેવ 41-41 સંત-સતીજીઓને ધ્યાન સાધના, સ્વનો સ્વાધ્યાય અને શાસ્ત્રોનો ગહન અભ્યાસ કરાવી, એમાં રહેલાં એક-એક સિકેટ્સ અને ભાવાર્થને સમજાવી, એમના વૈરાગ્ય ભાવોને દઢતમ કરતાં હતાં. હિત શિક્ષાઓ અને પ્રેરક બોધ વચનો

ફરમાવી 5 વર્ષના, 3 વર્ષના, 1 વર્ષના અને 2 મહિનાના દીક્ષિત સંત-સતીજીઓના સંયમ જીવનનું અનન્ય ઘડતર કરી રહ્યાં હતાં.

સોનામાં સુગંધ ભળે એમ જ્ઞાનપિપાસુ આત્માઓને યોગ થયો બનારસ હિન્દુ યુનિવર્સિટીનો અને એમાં રહેલાં ઈંગ્લીશ, હિન્દી, સંસ્કૃત, પ્રાકૃત આદિ ભાષાઓના 16 લાખથી વધુ પુસ્તકોનો !

આજના યુગના યુવા ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને ડૉક્ટરેટ થએલાં શિક્ષિત અને દીક્ષિત સંત-સતીજીઓને આત્મ કલ્યાણકારી, અધ્યાત્મ અને આગમ જ્ઞાનથી સમૃદ્ધ કરવા, એમની આંતરિક શક્તિઓનું પ્રાગટ્ય કરવા રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ એ જાણે પ્રારંભ કરી દીધો શ્રુતજ્ઞાનનો મહાયજ્ઞ ! અને સર્વ સંત-સતીજીઓને જોડી દીધાં જ્ઞાન પુરુષાર્થમાં !

સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જ્ઞાન વૃદ્ધિકર પુસ્તકોની લાઈબ્રેરીમાં જ્ઞાન આરાધના, સંશોધન, જ્ઞાનાભ્યાસ અને સાથે-સાથે સમજ અને આત્મચિંતન... અગત્યના પોઈન્ટસની નોંધ કરવી, ન સમજાતાં સૂત્રોનું પરમ ગુરુદેવ પાસેથી સમાધાન પ્રાપ્ત કરવું, એ જ લક્ષ્ય અને એ જ સાધના !

પાર્શ્વનાથ વિદ્યાપીઠમાં પણ જૈનીઝમના હજારો-હજારો પુસ્તકો છે. નવદીક્ષિત સંતોએ આ જ વિદ્યાપીઠમાં 15 દિવસથી વધુ રહીને જ્ઞાનાભ્યાસ કર્યો હતો. ત્યાં રહેલાં એક-એક પુસ્તકોનું વિહંગાવલોકન કરીને, સ્વયંની જ્ઞાનરૂચિને વધુ દઢ બનાવી હતી.

પરમ ગુરુદેવના આ શ્રુતજ્ઞાન મહાયજ્ઞમાં પાર્શ્વનાથ વિદ્યાપીઠના શ્રી ઓમપ્રકાશજીની સહાય, સંત-સતીજીઓની વૈયાવચ્ચ અને શાતા પમાડવાની ભાવના પ્રશંસનીય હતી. પરમ ગુરુદેવ પાસેથી એમને પાર્શ્વનાથ વિદ્યાપીઠનો વિકાસ કરવા માટેનું અને ત્યાં કેવી-કેવી નવી પ્રવૃત્તિઓ કરવી તેનું ઉપકારક માર્ગદર્શન પ્રાપ્ત થતાં તેઓ કૃતાર્થ થયાં હતાં.

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના આ શ્રુતજ્ઞાન મહાયજ્ઞની





વાત તો વાયુવેગે પ્રસરી ગઈ. દેશ-પરદેશના વિવિધ ક્ષેત્રોમાં અને અનેક જ્ઞાન પ્રાપ્તિના ઉત્સુક આત્માઓની જિજ્ઞાસા જાગૃત થવા લાગી...

India માં રહેલાં અનેક ક્ષેત્રો તથા Indiaની બહારના દુબઈ, મલેશિયા, સુદાન, સિંગાપોર, મલાકા, યુગાન્ડા, લંડન, સ્વીડન, Seattle, વર્જિનીયા, એટલાન્ટા, ન્યુયોર્ક, વોશિંગ્ટન, ન્યુજર્સી, બોસ્ટન, શિકાગો આદિ ક્ષેત્રોના ભાવિકોને આ પાવનભૂમિ પરથી લાઈવ ટેલીકાસ્ટના માધ્યમથી પરમ ગુરુદેવશ્રીએ, ખાસ એમના જ માટે સવિશેષ જ્ઞાનવર્ધક પ્રવચન ફરમાવી એમના મનના અનેક પ્રશ્નો અને સંશયોનું સચોટ સમાધાન આપ્યું હતું.

સર્વની ભાવના અને પરમ ગુરુદેવની અનંતી કૃપાનો સમન્વય એટલે જૈન-ક્રાંતિનો આ શ્રુતજ્ઞાન અમૃતરસ અંક !

આ અંકમાં આપશ્રીને વાંચવા મળશે...

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવનું આત્મચિંતન, પ્રભુ વચનો પર કરેલી એમની અનુપ્રેક્ષા, આત્મશુદ્ધિકર અમૃતવાણી, આત્મહિતકારી પ્રેરક વચનો સાથે સંત-સતીજીઓએ કરેલાં અભ્યાસનું તારણ, જ્ઞાન સાધનાના એમના ભાવો અને શ્રુતજ્ઞાન મહાયજ્ઞની ફળશ્રુતિ સાથે ઘણું બધું...

આ અંકમાં આપેલ જ્ઞાન ઉપકારક પુસ્તકો અંગેની માહિતી અને પુસ્તકોમાંથી કાઢેલ સારતત્ત્વ સર્વ સંપ્રદાયના સંત-સતીજીઓના વૈરાગ્યભાવને વધુ પુષ્ટ કરે, એમના જ્ઞાનગુણમાં વૃદ્ધિ કરે અને જ્ઞાનપ્રાપ્તિના પુરુષાર્થમાં એક આધાર રૂપ બને એવી પરમ ગુરુદેવની કૃપા અને સદ્ભાવના સાથે...

“

મન જ્યારે સત્ પ્રત્યે ગમો ઉત્પન્ન કરે

ત્યારે સત્ પ્રત્યે શ્રદ્ધા પ્રગટ થાય.

મન જ્યારે અસત્ પ્રત્યે ગમો ઉત્પન્ન કરે

ત્યારે અસત્ પ્રત્યે શ્રદ્ધા થાય.

”

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના શ્રુતજ્ઞાન મહાયજ્ઞમાં જોડાયાં
જ્ઞાનપિપાસુ સંતો અને પરમ મહાસતીજીઓ...



બનારસ હિન્દુ યુનિવર્સિટી અને પાર્શ્વનાથ વિદ્યાપીઠમાં સહુએ કર્યો જ્ઞાનાભ્યાસ !

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી તમ્મુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી...

પૂજ્ય સંત-સતીજીઓએ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં વાંચન-ચિંતન કરેલાં પુસ્તકોનું વિવરણ




યોગશાસ્ત્ર:

મૂળ લેખક: કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી
અનુવાદ: મુનિ શ્રી પદ્મવિજયજી મ.સા.

આ યોગશાસ્ત્રમાં વ્યવસ્થિત રૂપે અને ક્રમાનુસાર મોક્ષમાર્ગની સમજ આપવામાં આવી છે. સમ્યૂક જ્ઞાન, સમ્યૂક દર્શન, સમ્યૂક ચારિત્ર (5 મહાવ્રત, 12 અણુવ્રત, 5 સમિતી, 3 ગુપ્તિ), 35 માર્ગાનુસારીના ગુણ, સમ્યૂક દર્શનીના લક્ષણ, સમ્યૂક દર્શનનું આભૂષણ, 28 પ્રકારની લબ્ધિઓ આદિ સાથે વિવિધ યોગાસનો, પ્રાણાયામ તથા ધ્યાનની અલગ-અલગ ટેકનીકસૂ સમજાવવામાં આવી છે.

- પૂજ્ય શ્રી વિનમ્મુનિ મહારાજ સાહેબ



Introduction to Jainism

Writer : Jeffery . D. Long

આ પુસ્તકમાં લેખક શ્રી એ જૈનીઝમને જાણીને, જૈનીઝમનો અભ્યાસ કરીને, જૈનીઝમના અલગ-અલગ સિધ્ધાંતો અહિંસા, અનેકાંતવાદ, અપરિગ્રહ, કર્મ થીયરી, આગાર - અણગાર ધર્મ, નવ તત્ત્વ, ભગવાન મહાવીરના જીવનદર્શનનું સુંદર વિવરણ કર્યું છે અને સાથે-સાથે જૈન દર્શનની તુલના તે સમયના અન્ય દર્શન સાથે કરી છે.

ટૂંકમાં, જૈનીઝમને ન જાણનાર વાચક પણ આ પુસ્તક વાંચી જૈનીઝમને સહજતાથી સમજી શકે તે રીતે સમજાવ્યું છે.

- પૂજ્ય શ્રી વિનમ્મુનિ મહારાજ સાહેબ

इसि भाषियं श्रुतः

સંપાદક: મહોપાધ્યાય શ્રી વિનયસાગરજી

પ્રાકૃત ભાષાના આ ગ્રંથમાં 45 જેટલાં ઋષિઓના બોધ વચનોને સંકલિત કરવામાં આવ્યાં છે, જેમાંથી કેટલાંક ઋષિઓ શ્રી નેમનાથ પરમાત્માના સમકાલિન છે તો કેટલાંક ઋષિઓ પ્રભુ પાર્શ્વનાથ પરમાત્મા અને કેટલાંક ભગવાન મહાવીરસ્વામીના સમકાલિન છે. આ ગ્રંથમાં પાર્શ્વનાથ પરમાત્માના બોધવચનો પણ આપેલ છે.

‘ઋષિ ભાષિત’ આ ગ્રંથ પ્રાકૃતના જૂનામાં જૂના સાહિત્યમાંનો એક ગ્રંથ છે.

- પૂજ્ય શ્રી વિનમ્મુનિ મહારાજ સાહેબ







Zen Buddhism : Shree D. T .Suzuki

Basic Buddhism of Zen : Nan Huai Chin


The Spirit of Zen : Alen W. Watts

Zen Buddhism : Christran Hunphreys.

Zen એક એવી કોમ્યુનિટી છે જે બૌદ્ધિઝમની અત્યાર સુધી ચાલી આવતી સીસ્ટમથી અલગ છે. તેઓની ડીસીપ્લીનના નિયમો, નિર્વાણના લક્ષ્ય સાથેના સિધ્ધાંતો, તેમના સાધુ જીવનની શૈલી આદિ ઘણું બધું જૈનધર્મના સિધ્ધાંતો અને જૈન સાધુની જીવન શૈલીથી મેચ થાય છે. ચાઇના, કોરિયા, જાપાનમાં Zen સિસ્ટમ પ્રચલિત છે, આવા પ્રકારની માહિતી આ બધાં ‘Zen’ ના પુસ્તકોમાં આપવામાં આવી છે.



- પૂજ્ય શ્રી વિનમ્મુનિ મહારાજ સાહેબ



જૈનદર્શન મેં ધ્યાન કા ઐતિહાસિક વિકાસ ક્રમ લેખક : ડૉ.પૂ. શ્રી ઉચિતપ્રભાજી

અલગ-અલગ પરંપરાઓ વૈદિક, બૌદ્ધ, જૈન આદિમાં આવતાં ધ્યાન માટેની વિગતો, જૈન આગમદર્શન ગ્રંથોમાં કઇ-કઇ ગાથાઓમાં ધ્યાન વિશેનું મહત્ત્વ આપ્યું છે તથા આચાર્ય રચિત શાસ્ત્રો, યોગશાસ્ત્રો, યોગબિંદુ આદિમાં વર્ણવેલ ધ્યાન અંગેની માહિતી આપતું આ પુસ્તક છે.



- પૂજ્ય શ્રી વિનમ્રમુનિ મહારાજ સાહેબ

જૈન પરંપરા મેં ધ્યાન કા સ્વરૂપ : લેખિકા : શ્રી સીમા રાણી શર્મા

આ એક એવું પુસ્તક છે, ધ્યાનને વિશ્વસ્તર પર કેવી રીતે સ્વીકારવામાં આવ્યું છે, જૈનોમાં, વૈદિકમાં ધ્યાનનું મહત્ત્વ, દરેકની વિવિધ ક્રિયાઓ, વિવિધ ભાવો અને સ્વયંની પરંપરાઓનું વર્ણન આપવામાં આવ્યું છે.

ધ્યાનની પરિભાષા, ધ્યાનથી થતા શારીરિક, માનસિક અને આત્મિક લાભનું સવિશેષ વર્ણન દર્શાવ્યું છે.

- પૂજ્ય શ્રી પરમ પ્રભુતાજી મહાસતીજી



KARMA Rhythmic Return To Harmony Edited by - Shree V. Hanson, Shree R. Seewart, Shree S. Nicholson

આ પુસ્તકમાં કર્મોનું બંધન સંસાર પરિભ્રમણનું કારણ છે એ સત્ય સાથે એ પણ દર્શાવ્યું છે કે આપણે કર્મોના ગુલામ બની ગયાં છીએ, કર્મોની આ ગુલામીમાંથી આપણે મુક્ત થઈ શકીએ છીએ જો પુરુષાર્થ કરીએ તો ! કર્મો રહિત અવસ્થાને પ્રાપ્ત કરવા નિઃસ્વાર્થતા જરૂરી છે એ ભાવો સાથે, Albert Einstein's Third Theory, " To Every Action, there is an equal and opposite Reaction" નું સુંદર વિશ્લેષણ આપવામાં આવ્યું છે.

- પૂજ્ય શ્રી પરમ પ્રભુતાજી મહાસતીજી

Aparigrah - The Humane Solution Author - Shree Kamlaji Jain

આજથી 2574 વર્ષ પહેલાં તીર્થંકર પરમાત્મા પ્રભુ મહાવીરે કહ્યું હતું, અતિ ડિમાન્ડ વાતાવરણ માટે પ્રતિકૂળતા સર્જશે અને લાકો માટે દુઃખનું કારણ બનશે.

પ્રભુના આ સિદ્ધાંતના આધારે આ પુસ્તકમાં અપરિગ્રહ ના કોન્સેપ્ટને એવી રીતે વર્ણવ્યો છે કે, એ સત્ય સાબિત થઈ જાય છે કે અપરિગ્રહ જ આ વિશ્વના પર્યાવરણ અને સામાજિક સમસ્યાઓને સોલ્વ કરવાનું શ્રેષ્ઠ શસ્ત્ર છે.

- નવદીક્ષિતા પૂજ્ય શ્રી પરમ આત્મિયાજી મહાસતીજી



હે આત્મન્ ! બોધ પામ... સમજી જા... સત્યને પામ !

જે નામ, માન, સગા અને સંબંધોને સ્મશાનની ગોદમાં જઈને છોડવાના છે, એને આજે પ્રભુની ગોદમાં જવા માટે છોડી દે ! !

Scientific Explorations Of Jain Doctrines

Scientific Explorations Of Jain Doctrines

Author : Shree N.L. Kechhara

આજના યુવા વર્ગ માટે અત્યંત ઉપયોગી અને ઈંગ્લીશમાં આ પુસ્તક Text Book ના ફોર્મેટમાં છે. જૈનીઝમમાં દરેક સિધ્ધાંતો જૈનીઝમની થીયરી સાથે આત્મા, નવતત્ત્વ, Jain Physics, Jain Chemistry, Jain Biology, અનેકાંતવાદ આદિની સમજ સાથે તેના વૈજ્ઞાનિક સંબંધનું વર્ણન આપવામાં આવ્યું છે.

- પૂજ્ય શ્રી પરમ પાવનતાજી મહાસતીજી


Pearls Of Jain Wisdom

Author - Shree Dulichendji Jain

આ પુસ્તકમાં અલગ-અલગ વિષયો પર આગમની ગાથાઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે તથા તેનું ઈંગ્લીશમાં ટ્રાન્સલેશન પણ આપ્યું છે.

- નવદીક્ષિતા

પૂજ્ય શ્રી પરમ આત્મિયાજી મહાસતીજી



तीर्थकर महावीर और उनकी आचार्य परंपरा

लेखक : डॉ श्री नेमिचंदजी शास्त्री

આ પુસ્તકમાં લેખક શ્રી એ અથાગ પુરુષાર્થ અને ગહન અધ્યયન સહ જૈનત્ત્વના ચરમ તીર્થકર ભગવાન મહાવીર સ્વામીનું જીવન ચરિત્ર દીગમ્બર માન્યતા અનુસાર 5 વોલ્યુમ્સમાં પાઠક વર્ગની સમક્ષ પ્રસ્તુત કર્યું છે.

આ કાળમાં જૈનત્ત્વના આદિ કરનાર પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાનનું જીવનકવનનું વર્ણન હિન્દુ માન્યતાના વેદ શાસ્ત્રોમાં, બૌદ્ધ ગ્રંથોમાં ક્યા સ્થાને કરવામાં આવ્યું છે તેના સૂત્ર-પુરાવા સહ વર્ણન કરવામાં આવ્યું છે.

વીર પ્રભુ મહાવીરની વાણી, અતિશયની વિશેષતા, વિચરણ ક્ષેત્રો, નિર્વાણ ભૂમિ આદિનો રેફરેન્સ સાથેનો ઉલ્લેખ પ્રથમ ભાગમાં આપવામાં આવ્યો છે. પ્રભુ મહાવીરે દેશનામાં ફરમાવેલ નવ તત્ત્વનું સ્પષ્ટ અને તાત્વિક ભાષામાં વર્ણન કરવામાં આવ્યું છે.

શ્રી શાસ્ત્રીજીનો જૈન ઈતિહાસ અને તત્ત્વદર્શન માટે કરેલો પુરુષાર્થ પ્રશંસનીય છે.

- પૂજ્ય શ્રી પરમ ઋષિતાજી મહાસતીજી


Arhat Parswa & Dharnendra Nexus

Editor - Shree M.A.Dhaky

આ એક એવું પુસ્તક છે, જેમાં આપણા 23 માં તીર્થકર પરમાત્મા પાર્શ્વનાથ અને ધરણેન્દ્ર દેવ કેવી રીતે મળ્યાં તેનું વર્ણન છે.

- નવદીક્ષિતા

પૂજ્ય શ્રી પરમ આત્મિયાજી મહાસતીજી





EMOTIONAL INTELLIGENCE AT WORK

Author - Dalip Singh

આ Book માં IQ Verses EQ નું મહત્ત્વ સમજાવ્યું છે. આજના યુગમાં IQ કરતા EQ નું importance વધારે છે. IQ હશે તો 20% success મળશે પણ EQ હશે તો 80% success મળશે. IQ means Hardware of Head & EQ means Software of Heart. આ પુસ્તક માં વિવિધ experiments દ્વારા IQ & EQ ના Results સમજાવ્યાં છે. તમે કેવી રીતે EQ વધારીને તમારી life માં Success લાવી શકો એની અનેક tips આ પુસ્તકમાં આપી છે.

- પૂજ્ય શ્રી પરમ અસ્મિતાજી મહાસતીજી





જૈન સાહિત્ય કા ઇતિહાસ

લેખક : શ્રી કૈલાસચંદ્રજી શાસ્ત્રી

જૈન ઇતિહાસમાં મહત્તમ યોગદાન આપતા આ પુસ્તકમાં અન્ય ધર્મોમાં પ્રભુ ઋષભદેવની સ્વીકૃતિ પર ગહન ચર્ચા કરવામાં આવી છે. સ્વયંની ઔતપાતિકા બુધ્ધિથી લેખકશ્રીએ ભગવાન મહાવીર, ગૌતમ બુધ્ધ, અભયકુમાર, શ્રેણિકરાજા, કોણિક રાજા, ગૌશાલક આદિ

ઐતિહાસિક વ્યક્તિઓની વચ ગણના કરી છે. ભગવાન મહાવીરના નિર્વાણ બાદ શ્રુતકેવળીના કાળની, પૂર્વધરોના કાળની, પુરાવા સહ ગણના કરી છે.

તીવ્ર મેધાના પ્રયોગથી દીગમ્બર અને શ્વેતામ્બર પંથનો અભ્યાસ કરી અનેક નવી ધારણાઓ વાચકો સમક્ષ પ્રસ્તુત કરવામાં આવી છે.

શ્રી શાસ્ત્રીજીનો આ તુલ્યાત્મક અભ્યાસ વાચક વર્ગ માટે ઇતિહાસના ઘણા પાસાઓ ઉઘાડનાર છે.

- પૂજ્ય શ્રી પરમ ઋષિતાજી મહાસતીજી



અપભ્રંશ કા જૈન સાહિત્ય ઓર જીવન મૂલ્ય

લેખિકા - સાધ્વી શ્રી સાધનાજી

આ પુસ્તકમાં સાધ્વી શ્રી સાધનાજી એ અપભ્રંશ ભાષામાં રચાયેલા 300 થી પણ વધારે જૈન સાહિત્યનો ઊંડાણ પૂર્વક અભ્યાસ કરીને, સમાજ સમક્ષ ક્યારેય ન થયેલાં અને જેસલમેરના ભંડારોમાંથી પ્રાપ્ત હસ્ત લિખીત ગ્રંથોને એક નવી દિશા આપી છે.

અપભ્રંશ ગ્રંથોમાં વર્ણવેલા ઇતિહાસમાં ઉજવાતા જન્મોત્સવ, અભ્યાસ શૈલી, સાધ્વાચાર આદિ અનેક વિષયોનું પૂર્વ કાલિન અને વર્તમાન કાલીન જીવન મૂલ્યોનો તુલનાત્મક અભ્યાસ આપ્યો છે.

જૈન સાધુઓનું વિચરણ અન્ય દેશોમાં કયા કાળે, કયા ક્ષેત્રમાં થયું છે તેનું પુરાવા સાથે વર્ણન શ્રી સાધ્વીજીએ આપ્યું છે.

- પૂજ્ય શ્રી પરમ ઋષિતાજી મહાસતીજી

જૈન સાહિત્ય કા બૃહદ ઇતિહાસ

લેખક - શ્રી અંબાલાલજી શાહ

આ પુસ્તકમાં શ્રી અંબાલાલજીએ અથાગ પુરુષાર્થ કરી જૈન સાહિત્યમાં સુવર્ણ ઇતિહાસનું સંકલન કર્યું છે. આ પુસ્તકનું અવલોકન કરતાં જૈન શાસનની સાહિત્ય સમૃદ્ધિ સાથે જૈનાચાર્યો અને વિદ્વાન શ્રાવકોની જ્ઞાનપ્રિયતાના દર્શન થાય છે.

વ્યાકરણમાં વૃત્તિ, ટીકા, ટીપણી, શબ્દકોશ આદિ લગભગ 189 ગ્રંથોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અદ્ભૂત વાત તો એ છે કે, જૈન સાધુ ભગવંતોએ ફારસી, કન્નડ વ્યાકરણની પણ રચના કરી છે. અલંકાર શાસ્ત્ર, ઈન્દ્ર, નાટ્ય, સંગીત, કલા, ગણિત, જ્યોતિષ, શકુન શાસ્ત્ર, નિમિત્ત શાસ્ત્ર, સ્વપ્ન શાસ્ત્ર, ચૂડામણિ, આયુર્વેદ, કોષ્ટક ચિંતામણી અર્ધ શાસ્ત્ર, રત્ન પરિક્ષા, જેવા વિભિન્ન વિષયો પર ગ્રંથોની રચના કરી છે.

આ પુસ્તક વાંચતા-વાંચતા, જ્ઞાની સાધુ-સાધ્વીજી ભગવંતના શ્રુત પુરુષાર્થ પ્રત્યે અહોભાવ પ્રગટ થયો હતો. એમની અપ્રમતતા અને સ્વાધ્યાય પ્રિયતાને વારંવાર વંદન કરવાના ભાવ થયાં હતાં.

- પૂજ્ય શ્રી પરમ ઋષિતાજી મહાસતીજી





BUDDHA

Author - Shree Deepak Chopra

ગૌતમ બુધ્ધ જે ભગવાન મહાવીરના સમકાલીન હતાં તેમનું જીવનદર્શન ખૂબ જ સુંદર શૈલીમાં વર્ણવ્યું છે. એક સામાન્ય વ્યક્તિ કેવી રીતે અસામાન્ય બન્યાં તેની સંપૂર્ણ જર્ની આ પુસ્તકમાં આપવામાં આવી છે.

- પૂજ્ય શ્રી પરમ સમ્યક્તાજી મહાસતીજી





ARISTOTLE ON MEMORY


Author - Shri Richard Sorabji

આ પુસ્તકમાં મેમરીઝ કેવી રીતે બને અને મેમરીઝને સ્ટ્રોંગ કરવા માટેની ટેકનીકસ્ શું હોય એનું સુંદર વર્ણન કર્યું છે. જેમકે, મેમરીઝને સ્ટ્રોંગ કરવા પહેલાં મનમાં એક ઇમેજને સેટ કરવી જોઈએ. એ ઇમેજ મોટી અને બ્રાઇટ હોવી જોઈએ. મેમરીઝને વધારવા કોસ કવેશ્યન્સ કરવા જોઈએ.

એના ઉપર વારંવાર ચર્ચા કરવી જોઈએ જેથી મેમરીઝને સ્ટ્રોંગ કરી શકાય.

બાળકની મેમરીઝ કેવી હોય, વૃદ્ધની મેમરીઝ કેવી હોય, પશુ-પક્ષીઓની મેમરીઝ કેવી હોય એની સમજ આપી છે.

- પૂજ્ય શ્રી પરમ અસ્મિતાજી મહાસતીજી



Nagarjuna's Letters to King Gautamiputra.

નાગાર્જુના એક બૌદ્ધ આચાર્ય હતાં, જેમણે પોતાના શિષ્ય ગૌતમીપુત્રના કષાયોને શાંત કરવા માટે જે પત્રો લખ્યાં હતાં તેનો સંગ્રહ આ પુસ્તકમાં છે.

આચાર્યના આ હિતશીક્ષા આપતાં પત્રો વાંચતા એમાં જૈનીઝમના સિધ્ધાંતોનું દર્શન થયું.

જેમકે, આચાર્યશ્રીએ લખ્યું છે, મનમાં ઉઠતાં વિચારો ૩ પ્રકારના હોય - પાણીમાં કરેલી લીટી જેવા, રેતની લીટી જેવા અને પથ્થર પર કરેલી લીટી જેવાં! આ સામ્યતા જૈનદર્શનમાં દર્શાવેલા અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, સંજ્વલન આદિ કષાયો માટે બતાવી છે,


આ ઉપરાંત આ પુસ્તકમાં પુણ્યાનુબંધી પુણ્ય, પાપાનુબંધી પુણ્ય આદિનું વર્ણન છે.

એક પત્રમાં આચાર્યશ્રીએ શિષ્યને માત્ર મધ્યરાત્રિ બાદ જ સૂવાની સલાહ આપી છે, જૈનદર્શનમાં પણ સાધુને રાત્રિના ત્રીજા પ્રહરમાં સૂવાની આજ્ઞા છે.

- પૂજ્ય શ્રી પરમ અસ્મિતાજી મહાસતીજી

લેશ્યાકોષ

લેખક: શ્રી મોહનલાલ બાંઠિયા



આ એક એવું પુસ્તક છે જેમાં, જીવનને અનાદિકાળથી જેની સાથે શાશ્વત સંબંધ છે એ લેશ્યાનું વિસ્તૃત વર્ણન આપવામાં આવ્યું છે, લેશ્યાના પ્રકાર, લેશ્યાના લક્ષણો, લેશ્યાનું સ્વરૂપ, વર્ણ, ગંધ, અવગાહના, પ્રદેશ, રસ, સ્પર્શની સાથે હર એક જીવોની ગતિ પ્રમાણે લેશ્યાની કેટેગરીનું વર્ણન આપવામાં આવ્યું છે. લલ્લિથી તેજોલેશ્યા અને શીતલેશ્યા કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તેનું વર્ણન આપવામાં આવ્યું છે. પ્રભુ મહાવીરના જીવનદર્શન આધારે તેજોલેશ્યામાં કેવી રીતે પ્રતિઘાત આપી શકાય એનું વર્ણન આપવામાં આવ્યું છે.

આ ઉપરાંત શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, શ્રી ભગવતી સૂત્ર, શ્રી ઠાણાંગ સૂત્ર અને શ્રી પન્નવણા સૂત્ર આદિ આગમોની ગાથાઓના આધારે લેશ્યા ઉપર સુંદર વિવેચન કરવામાં આવ્યું છે, અનેક આચાર્યશ્રીના મંતવ્ય અને સંસ્કૃતના શ્લોકો સાથે લેશ્યાની સમજ આપી છે.

-પૂજ્ય શ્રી પરમ સાત્વિકાજી મહાસતીજી

Ayurvedic cooking for self healing

Author - Shree Usha lad, Dr. Vasant lad

આ યુગમાં શારીરિક સ્વસ્થતા જાળવવા Detician નું માર્ગદર્શન મળી રહે છે. એવા યુગમાં આ પુસ્તકના લેખક Dr. Lad એ અથાગ પુરુષાર્થ કર્યો છે.

કઈ વસ્તુને કોની સાથે, કેવી રીત બનાવીને એનો ઉપયોગ કરવો, જેથી આહારની પૌષ્ટિકતા અને સ્વાદ બન્ને જળવાઈ રહે અને માટે 100 થી વધુ આયુર્વેદિક રેસિપી આપેલી છે.

- પૂજ્ય શ્રી પરમ સમાધિજી મહાસતીજી

Ayurvedic cooking for self healing

A Pack of Lies

A Pack of Lies

Author - Shree J.A. Barnes

આ પુસ્તકમાં અસત્ય પર વિસ્તારથી સમજ આપવામાં આવી છે. અસત્ય કોણ બોલે, શા માટે બોલે, કેટલાં પ્રકારના અસત્ય હોય, કઈ જાતિના લોકો વધારે અસત્ય બોલે અને કોઈનું અસત્ય કેવી રીતે પકડી શકાય તેનું વર્ણન આપવામાં આવ્યું છે.

એમ કહેવાય છે કે, એક સર્વે કર્યો હતો, 10 અલગ-અલગ કન્ડ્રીઝમાંથી ઘણા બધાં પેરેન્ટસને પૂછવામાં આવ્યું હતું કે, તમને તમારા બાળકોમાં સૌથી વધારે કયો ગુણ હોય તે જોઈએ છે, ત્યારે બધાંનો એક જ જવાબ હતો Honesty... પ્રમાણિકતા !

- પૂજ્ય શ્રી પરમ અસ્મિતાજી મહાસતીજી

THE Resonance of Emptiness

THE Resonance of Emptiness

Author - Shree Gay Watson

આ પુસ્તક 'સ્વ' ને મળવાનું અને 'સ્વ' ને સમજવાનું એક સુંદર માધ્યમ છે, આપણે આપણી નિત્ય લાઇફમાં ક્યાં જાગૃતિ રાખવાની છે, ક્યાંય કોઈનામાં ભળી ન જવાય એની સાવધાની કેવી રીતે રાખવી. I રોંગ થાય તો બધું રોંગ થવા લાગે, આ બધાંની સમજ આપી છે.

ધ્યાન સાધનામાં શ્વાસને માધ્યમ બનાવી દુનિયાથી કેવી રીતે ડિસ્કનેક્ટ થવું, આ જગતમાં આપણે બધાં કેવી રીતે એકબીજા ઉપર ડીપેન્ડેન્ટ છીએ, કેવી રીતે સૂર્ય પ્રકાશ અને વાદળાં આપણી માટે ઉપકારક છે, સાયકોથેરાપી અને મેડિટેશન કેવી રીતે સમાન છે તથા મેડિટેશનનું કેટલું મહત્વ છે, તેનો ઉલ્લેખ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે.

- નવદીક્ષિતા પૂજ્ય શ્રી પરમ નમસ્વીજી મહાસતીજી

જૈન સંસ્કૃતિ ઓર ઇતિહાસ લેખક - ડૉ. શ્રી ભોગચંદ્રજી ભાસ્કર

આ પુસ્તકમાં ભગવાન મહાવીરના સમયથી લઈ આજ સુધી કેટલાં આચાર્ય બન્યાં, અલગ-અલગ પરંપરાઓ, સંપ્રદાયની માન્યતાઓ અને પંથોના ભેદ બનવા પાછળના મતભેદના હેતુઓ બતાવ્યાં છે. જેમકે, દીગમ્બરમાં મૂળ સંઘ, નંદી

સંઘ, દ્રવિ સંઘ (તામિલ), કસ્થા સંઘ, તેરાપંથ સંપ્રદાય, તપાગચ્છ, અચલગચ્છ સંઘ, પાર્શ્વનાથ ગચ્છ વગેરે... જે પંથ બન્યા એની પાછળ શું હેતુ હતાં તે દર્શાવ્યું છે.

સાથે-સાથે પાલી સાહિત્યમાં જૈનીઝમનું શું સ્થાન છે તે અને નવ તત્ત્વ પર વિસ્તારથી પ્રકાશ પાડ્યો છે, આ ઉપરાંત વાર્તાઓ પણ છે.

- પૂજ્ય શ્રી પરમ ઋષિતાજી મહાસતીજી

AN INQUIRY INTO CAUSES OF PAIN & SUFFERING

Author - Debashish Guha

આ Book માં Pain કેટલા પ્રકારના હોય. Physical, Pathological, Psychogenic. etc એ બતાડ્યું છે. Pain માટે Jainism નો દષ્ટિકોણ, સાથે અન્ય કર્મ Pain અને Suffering ને કવી રીતે રિલેટ કરે છે, તેનું દર્શન એટલે આ પુસ્તક !

આમાં Phantom limb ને Psychology સાથે રિલેટ કર્યું છે. જેવી રીતે amputation વખતે જે Pain થાય અને એની deep memory set થઈ જાય પછી એ પગ ન હોવા છતાં જ્યારે Pain થાય, એને Phantom limb કહેવાય.

એમ આપણી સાથે પણ કોઈ દુખદ ઘટના એક વાર થયા બાદ જ્યારે એની deep memory set થાય પછી વારંવાર તે પ્રસંગ યાદ કરીને આપણને આવું Pain થાય.

- પૂજ્ય શ્રી પરમ અસ્મિતાજી મહાસતીજી

જૈન સંસ્કૃતિ ઓર ઇતિહાસ

AN INQUIRY INTO CAUSES OF PAIN & SUFFERING

Ayurvedic Nutrition

Ayurvedic Nutrition

Author - Shree Vaidya Atreya Smith

આ પુસ્તકના લેખક સ્વયં વૈદ્ય છે. તેઓએ સ્વયં આયુર્વેદમાં અથાગ પુરુષાર્થ અને અભ્યાસ કરી સાત્ત્વિક અને સ્વસ્થ જીવનશૈલી જીવવાનું સરળ માર્ગદર્શન આપ્યું છે.

આયુર્વેદમાં રહેલાં શારીરિક પ્રકૃતિના રસપ્રદ રહસ્યોનું વર્ણન આપતું આ પુસ્તક સામાન્ય અને અજ્ઞાની વ્યક્તિને પણ સહજ શારીરિક સંતુલનને જાળવનારા માટે સરળ ઉપચારોનું જ્ઞાન પ્રદાન કરે છે.

- પૂજ્ય શ્રી પરમ સમાધિજી મહાસતીજી

નમો અરિહંતા

નમો અરિહંતા

લેખક : શ્રી એ. અસફલ (મધ્ય પ્રદેશ)

આ પુસ્તકમાં આનંદ નામના એક બાળકની વાતને અત્યંત માર્મિક અને ભાવવાહી શૈલીમાં વર્ણવી છે.

હિન્દુ પરંપરાને માનતો એ બાળક આનંદ જ્યારે યુવાન થાય છે અને એક જૈન સ્પર્શી જાય છે, કેવી રીતે જૈનત્વથી આકર્ષિત થાય છે, કેવી રીતે જૈનધર્મથી અહોભાવિત થાય છે, અને તેના જીવનમાં કેવા-કેવા પરિવર્તનો આવે છે, તેની રસપ્રદ વાતને સુંદર શૈલીમાં આલેખિત કરી છે.

- પૂજ્ય શ્રી પરમ ઋષિતાજી મહાસતીજી

Sanskrit Vyakaran

Author - DR. priti Prabha Goel

લેખિકાશ્રીએ આ પુસ્તિકામાં સંસ્કૃત ભાષાના, વ્યાકરણને સુંદર શૈલીમાં રજૂ કરી છે.

આ પુસ્તિકામાં સમાસ, સંધિ, તદ્ધિત, જેવા વિષયો પર વિશેષ સમજણ આપવામાં આવી છે.

સર્વ સંસ્કૃત અભ્યાસના ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે આ પુસ્તક ખૂબજ સહાયરૂપ છે.

- પૂજ્ય શ્રી પરમ સમાધિજી મહાસતીજી

Sanskrit Vyakaran

ઈસ્સયોગમાં મનનું મહત્વ

Author : મહાત્મા શ્રી સુશીલકુમાર મ્હા વિજયા

મનને પુરેપુરુ ગુરુના ચરણમાં સમર્પિત કરી દેવું જોઈએ. જો મનમાં સતત વિચારો ચાલતા હોય તો તે ગુરુની કૃપાને ગ્રહણ કરી શકતું નથી અને જે પામવાનું હોય તે ગુરુના શરણમાં પામી શકતાં નથી.

આ પુસ્તકમાં આ ભાવ દર્શાવ્યા છે.

- પૂજ્ય શ્રી પરમ કૃપાજી મહાસતીજી

ઈસ્સયોગમાં મનનું મહત્વ

Jain Theory of Reality

Author - Shree J. C. Sindai

આ પુસ્તકમાં છ દ્રવ્ય અને આગમ સંબંધિત સમજ છે. જૈનીઝમ અને સાયન્સ બંનેની સામ્યતા અને વિવિધતા બતાવવામાં આવી છે.

આ પુસ્તકમાં જૈનદર્શનની વાસ્તવિકતા દર્શાવવામાં આવી છે.

- નવદીક્ષિતા

પૂજ્ય શ્રી પરમ નમસ્વીજી મહાસતીજી

Jain Theory of Reality

Doctrines of AHIMSA

Doctrines of AHIMSA

Author - Shree Vasudevji
(Hindi, English, Urdu)

આ પુસ્તકમાં લખ્યું છે કે, આખું વિશ્વ શાંતિ માટે મિટીંગ્સ કરે પણ અંતે તો યુદ્ધ જ થાય. વિશ્વશાંતિ માટે કોઈ શ્રેષ્ઠ શસ્ત્ર હોય તો તે 'અહિંસા' છે. આ પુસ્તકમાં ઉર્દુમાં કાવ્ય આખ્યાં છે જેનું હિન્દીમાં પણ ટ્રાન્સલેશન કરવામાં આવ્યું છે અને ઇંગ્લીશમાં એનો ભાવાર્થ આપવામાં આવ્યો છે.

આ પુસ્તકમાં 5 ચેપ્ટર્સ છે અને બધાં જ કાવ્યરૂપમાં છે. ભાષા ખૂબ જ પ્રિય અને સૌમ્ય છે, આ પુસ્તકમાં રામાયણ અને મહાભારતની સાથે દેશની સ્વતંત્રતા વખતે કેવી રીતે અહિંસાનો આધાર લીધો હતો, તેનું વર્ણન આપ્યું છે.

- પૂજ્ય શ્રી પરમ અસ્મિતાજી મહાસતીજી

वनराज से जिनराज

लेखक - श्री विकर्षसागरजी

ભગવાન મહાવીરના પુનર્જન્મો અને ચરમ ભવને દર્શાવતા આ ચરિત્ર પુસ્તકમાં ભગવાનના જીવન કવનને દિગંબર પરંપરા અનુસાર સુંદર રીતે દર્શાવેલ છે. એક ભવમાં યમરાજ, બીજા ભવમાં જિનરાજ ભગવાનના નાના-નાના જીવન પ્રસંગો દ્વારા પ્રભુના મોટા સિદ્ધાંતોને વણી લેતી આ અદ્ભૂત સંકલન ચિત્રોના માધ્યમથી વધુ આકર્ષક લાગે છે.

- પૂજ્ય શ્રી પરમ જિનવરાજી મહાસતીજી

वनराज से जिनराज

Jainism with Scientific Approach

આ પુસ્તકમાં જૈનીઝમને સાઇન્ટીફિક એપ્રોચથી દર્શાવવામાં આવેલ છે. જૈન ફિલોસોફી કોઈ વ્યક્તિની લાઇફને કેવી રીતે શ્રેષ્ઠ બનાવી શકે તેનું વિસ્તારપૂર્વક વર્ણન આપવામાં આવ્યું છે.

જૈનીઝમને માત્ર ધર્મના દૃષ્ટિકોણથી ન નિહાળતાં, તેનાં નાનામાં નાના સિદ્ધાંતોને પ્રેક્ટીકલી સમજી શકીએ, એવી શૈલીમાં આ પુસ્તક લખાયું છે.

- પૂજ્ય શ્રી પરમ સમ્યક્તાજી મહાસતીજી

Jainism with Scientific Approach.

Process of Ayurveda

Author - DR. Robert

જ્યારે કોઈ છોડ કે ઝાડને ખીલેલું રાખવું હોય તો તેના પાંદડે નહીં પણ મૂળિયાંને પાણી નાંખવામાં આવે છે અને આ પુસ્તકના લેખક Dr. Robert એ પણ શારિરીક અસ્વસ્થતા નું મૂળ કારણ પ્રકૃતિની અજ્ઞાનતાને કહ્યું છે.

જે વાત, પિત્ત અને કફથી વ્યક્તિની પ્રકૃતિ બનેલી છે એને સ્વયં ઓળખી, એના મુજબ સ્વસ્થતા જાળવવા માટેનું ગહન જ્ઞાન અને વિજ્ઞાનનું દર્શન આ પુસ્તિકામાં થાય છે. આ પુસ્તિકા માનવીના શારિરીક અને માનસિક રોગોને જડમૂળથી દૂર કરાવનારી સાબિત થઈ શકે છે.

- પૂજ્ય શ્રી પરમ સમાધિજી મહાસતીજી

Process of Ayurveda

હે પ્રભુ! આજ સુધી શુદ્ધિનો અનુભવ કર્યો, હવે શુદ્ધિના પ્રતિક સંયમનો અનુભવ કરવો છે. સંયમની એક એવી પળનો અનુભવ કરવો છે જેમાં સત્યનું રીયલાઇઝેશન હોય, અહિંસાની આરાધના હોય અને બ્રહ્મચર્યનો નાભિનાદ પ્રગટતો હોય!

પ્રભુ! સંયમ એ જ મહાશુદ્ધિનું પ્રબળ પ્રતિક છે, માટે આત્મસંયમને જીવનનું અંતિમ લક્ષ્ય બનાવું છે.

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્મુનિ મહારાજ સાહેબનો

41-41 સંત-સતીજીઓ સાથે મહાનગર કોલકાતાથી
શ્રી સમ્મેત શિખરજી, રાજગૃહી, પાવાપુરી, નાલંદા,
બૌદ્ધ ગયા, કુંડલપુર અને ત્યાંથી પ્રભુ પાર્શ્વનાથની
જન્મભૂમિ કાશી - (વારાણસી) બનારસ
સુધીની જ્ઞાનવર્ધક અને દષ્ટિબોધક...

...વિહાર યાત્રા...

વિહારયાત્રામાં તીર્થંકર પરમાત્માઓના
પંચ કલ્યાણક ભૂમિની સંવેદનાશીલ સ્પર્શના...
જે બની રાષ્ટ્રસંત પરમ ગુરુદેવની આત્મ સ્પર્શના !

અને ત્યારે પ્રગટ થઇ...

પરમ ગુરુદેવના પ્રગાઢ અને રાત-દિનના આત્મચિંતનમાંથી...

આત્મશ્રેયસ્કર પ્રેરક બોધતત્ત્વની

અમૃતધારા !

એ અમૃતધારાની પ્રેરણા પામી, ધન્ય-ધન્ય બન્યાં...
40-40 સંત-સતીજીઓ, સાધકો અને ઉપસ્થિત ભાવિકો !

આવો...

એ અમૃતધારાના કંઈક અંશોનું આપણે પણ કરીએ અમૃતપાન !

આત્મચિંતનની અમૃતધારા

હે પ્રભુ !

તારું સમ્યક્ત્વ પામવું મારે !

-બોધગયા, 20.12.2019

કોઈક જ સિધ્ધ બની શકે છે, કલ્યાણ સાધી શકે છે, શ્રેષ્ઠતા સુધી પહોંચી શકે છે. કેમ બધાં નથી પહોંચી શકતાં ?

એની મૂળભૂતતા એક જ છે - મિથ્યાત્વભાવ.
મિથ્યાત્વ એટલે શું ?

‘સ્વ’ અને ‘પર’ના અસ્તિત્વને મિથ્યારૂપ અનુભવવું, જેવું છે તેવું ન અનુભવવું, મિથ્યા જોવું ને જાણવું. ‘ત્વ’ એટલે અસ્તિત્વ.

અનુભવ અસ્તિત્વનો થાય છે, નાસ્તિત્વનો થતો નથી.

બધાં સિધ્ધ બની શકતાં નથી કેમકે, જે પોતાના મિથ્યા અસ્તિત્વને અનુભવે છે, તેનો પુરુષાર્થ મિથ્યા અસ્તિત્વનો જ રહે છે. અનંતકાળથી આપણે ક્ષણ-ક્ષણ મિથ્યા અસ્તિત્વના અનુભવમાં જ પસાર કરી છે અને મિથ્યા અસ્તિત્વને જ દઢ કર્યો છે. દરેક પ્રાણી, જીવ-જંતુ પોતાના તે-તે અસ્તિત્વને અનુભવે છે અને પોતાના તે મિથ્યા અસ્તિત્વથી Satisfy રહે છે. માટે જ એક Piggy ને માણસ સામે જોઈ માણસ બનવાનું મન થતું નથી, કોઈ મારવા માટે આવે તો મરવું ગમતું નથી.

મિથ્યા અસ્તિત્વ કરાવનાર ઇન્દ્રિયો વારંવાર મિથ્યાત્વને પોષનારી બને છે અને તેના કારણે જ આપણે વારંવાર એ મિથ્યા અસ્તિત્વનો અનુભવ કરતાં રહીએ છીએ.

વિતરાગી અને કેવળજ્ઞાનીના પૂર્ણ શુધ્ધ આત્માના બોધ વચનો મળવા છતાં પણ આપણી દશા મિથ્યાત્વની છે. મોટાભાગે આપણે ક્ષણ-ક્ષણે મિથ્યા અસ્તિત્વને અનુભવી, મિથ્યા અસ્તિત્વની શૈલીમાં જ જીવી રહ્યાં છીએ. પૂર્ણ બોધ પ્રદાયક પ્રભુ મળવા છતાં પણ આપણે મિથ્યા અસ્તિત્વના અહેસાસમાં જ જીવી રહ્યાં છીએ.

આપણી મોટાભાગની પરિણતિ મિથ્યાત્વ સાપેક્ષ જ છે, સમ્યક્ત્વ સાપેક્ષ નથી અને તેના કારણે સમ્યક્ત્વ અનુભવવાનો ભવ મિથ્યાત્વના દઢીકરણમાં વીતાવી રહ્યાં છીએ.

દિવસોના દિવસો સુધી પ્રભુ શું કરતાં હતાં ?
પ્રસંગે-પ્રસંગે, સમયે-સમયે, મન-વચન-કાયાના યોગ મિથ્યા અસ્તિત્વનું જે દઢીકરણ હતું તેને વારંવાર સમજણ અને જ્ઞાન દ્વારા ઢીલું પાડી રહ્યાં હતાં.

મિથ્યા પણ ગુણસ્થાનક હોવાથી-બની

શકે કે કદાચ આપણે ગાઢ, દઢ કે અનંત મિથ્યાત્વમાં ન હોઈએ પરંતુ શૂન્ય મિથ્યાત્વમાં હોઈએ એવું પણ નથી.

આપણે મિથ્યા અસ્તિત્વના અહેસાસમાં જ રાગ કે દ્વેષ કરીએ છીએ, ગમો કે અણગમો કરીએ છીએ, પ્રિયતાનો કે અપ્રિયતાનો અનુભવ કરીએ છીએ.

જે ભવ મિથ્યાત્વના પર્યાયોને ઘટાડવાનો ભવ છે, સમ્યક્ત્વના દઢીકરણનો ભવ છે, જે માત્ર ને માત્ર મનુષ્યનો ભવ જ સમ્યક્ત્વનું દઢીકરણ કરી શકે એ ભવમાં પણ મિથ્યાત્વનું જ દઢીકરણ કરીએ છીએ.

મિથ્યાત્વ જેમ-જેમ દઢ થતું જાય છે એમ-એમ મિથ્યા મિથ્યાને જ જન્મ આપે છે. મિથ્યા જ મિથ્યાની જનની છે. એકથી બીજું, બીજાથી ત્રીજું, જન્મ થયાં જ કરે છે. જ્ઞાનીઓની દષ્ટિથી જો સ્થિતિઓને ઓળખીએ તો દરેક સ્થિતિમાં આપણો રોલ મિથ્યાત્વને દઢીકરણ કરવાનો જ થઈ રહ્યો છે.

પ્ર: મિથ્યાત્વની સાથે અનંતાનુબંધી કષાય કેમ હોય છે ?

ઉ: મિથ્યા અસ્તિત્વ અનંત અશુભોનું બંધ કરાવે છે. મિથ્યા અસ્તિત્વનો થતો રાગ-આકર્ષણ અને મિથ્યા અસ્તિત્વમાં થતો દ્વેષ અને દુ:ખ મિથ્યા અસ્તિત્વને કારણે ઘૂંટાઇ-ઘૂંટાઇને અનંત અનુબંધ સર્જીને અનંતાનુબંધી બનીને આપણા મિથ્યાત્વને Strong બનાવે છે અને એ Cycle ચાલ્યા જ કરે છે.

પ્ર: ઉત્તમતાનો યોગ પામ્યાં પછી પણ આવું કેમ થાય છે? મારા સમ્યક્ અસ્તિત્વને કેમ પામી શકાતો નથી?

ઉ: કેમકે, મારા અનંતકાળનો અભ્યાસ મિથ્યા અનુભવનો જ છે. એટલે ચેક કરો, મોટાભાગે સાધુ-સાધક કે શ્રાવક અવસ્થા આપણી મિથ્યાત્વ પોષક કે મિથ્યાત્વ મારક?

આપણી દરેક સગવડ, અનુકૂળતા, આપણો દરેક વ્યવહાર અને આપણું બાહ્ય અસ્તિત્વ માત્ર મિથ્યા છે. બધું જ મિથ્યા પોષક બની ગયું છે.

I Wrong છે તો My પણ Wrong છે.

પ્ર: સમ્યક્ અનુભૂતિ એકાંતથી Possible છે?

ઉ: સમ્યક્ અસ્તિત્વની અનુભૂતિ એકાંતથી નહીં પણ એક-કાંતથી શક્ય છે.

એકાંત એટલે સંયોગોથી એકાંત.

સંયોગોથી એકાંત નહીં પણ સંયોગોમાં પરિણમતી ઇન્દ્રિયોથી એકાંત!

સંયોગોથી કદાચ એકલા થશો પણ ત્યાં પાછું મન તો રહેશે જ અને મન પાછા સંયોગો ઉભા કરી નાંખશે.

એટલે વસ્તુ અને વ્યક્તિઓથી દૂર નહીં પણ વિચારો અને વચનોથી દૂર, જે મારા મિથ્યાત્વને દઢીકરણ કરનાર છે, આ એકાંત અતિશય જરૂરી છે.

જ્યાં સુધી સાવ સંયોગોથી વિરક્ત ન થઇ શકાય ત્યાં સુધી સમ્યક્ સંયોગો રાખવા પડશે.

પ્ર: મન સમ્યક્ સંયોગોને પણ મિથ્યામાં convert કરી શકે?

ભગવાને કહ્યું જ છે, ‘જે આસવા તે પરિસવા’, ‘જે પરિસવા તે આસવા.’

જે મિથ્યાત્વના કારણો છે તે સમ્યક્ત્વના કારણો છે. જે સમ્યક્ત્વના કારણો છે તે મિથ્યાત્વના કારણો છે.

એ પોતાના ઉપર જ આધાર રાખે છે.

એટલે જ સાધક અવસ્થામાં વારંવાર નિગ્રહ કરવામાં આવે છે, જેથી તે અનંતાનુબંધી મિથ્યા દશામાં ન ચાલ્યો જાય. નિગ્રહ એટલે

અટકાવવું, રોકવું.

પ્રભુની સાધનાનું લક્ષ પણ અલગ-અલગ પ્રકારે સંયોગોથી મુક્ત થઇ સ્વાનુભૂતિનું જ હતું. જેટલાં આત્માઓએ સ્વાનુભૂતિનો પુરુષાર્થ કર્યો છે એ જ મિથ્યાત્વમાંથી મુક્તિ પામી શક્યાં છે. સ્વાનુભૂતિ પામવા માટે પણ ઘણાં બધાં મિથ્યા અસ્તિત્વમાંથી પસાર થવું જ પડે છે અને એ સમયે કોઇને કોઇ રીતે મિથ્યા અસ્તિત્વ તેને વળગી જ જતાં હોય છે. દઢપણે વિચાર કરીએ તો સમજાશે કે મિથ્યા અસ્તિત્વ પછી એ ‘સ્વ’નું હોય કે ‘પર’નું, જો મિથ્યા અસ્તિત્વનો અનુભવ કરું છું તે પાસ્તના કર્મધીન છે, પણ એ કર્મને હું જેમ-જેમ ભોગવું છું એમ-એમ ફરી નવા કર્મો સર્જું છું.

“

જ્યાં વિકલ્પ હોય

ત્યાં સ્વીકાર ન હોય,

જ્યાં સ્વીકાર હોય

ત્યાં સર્વ શિરોમાન્ય હોય.

”

આજી એટલે...

મારા વિચારોના આગ્રહને છોડવા માટે

અપાયેલો ગુરુનો આદેશ!

- ગુરુભક્ત શ્રી મેઘાણી પરિવાર



પુરુષાર્થ મારી ફરજ... ફળ નિયતીનો ખેલ !

-કાશી, વારાણસી-27.12.2019

તમારો પુરુષાર્થ જ્યારે સફળ ન થાય ત્યારે જાત માટે નેગેટીવ ન થવું, વધારે પુરુષાર્થ કરવો અને વધારે પુરુષાર્થ કરવાવાળી વ્યક્તિ સફળ થયાં વિના રહેતી જ નથી અને કદાચ જો સફળ ન થાય તો એને નિયતિ માની એનો સ્વીકાર કરી લેવો જોઈએ.

જ્યારે કોઈ તમારી ટીકા કરે છે, તમારી સાથે નેગેટીવ વ્યવહાર કરે છે, તો એના સ્વરૂપમાં ગુરુ કે પરમાત્મા આવીને, તમને સુધારવા માગે છે. તમે પ્રેમથી, શબ્દોથી જ્યારે નથી સુધાર્યા, ત્યારે તમને સુધારવા માટે નિયતિએ એવું કોઈ તત્ત્વ સેટ કર્યું છે. જેને કારણે તમે એલર્ટ રહો, સાવધાન રહો, જાગૃત રહો.

નિંદક વ્યક્તિ હવા જેવી હોય છે. જો આગ નાનકડી હોય તો હવા એને બુઝાવી દે છે અને જો આગ મોટી હોય તો એ જ હવા એને પ્રજ્વલિત કરે છે, વધુને વધુ સ્ટ્રોંગ અને મોટી કરે છે. એમ જો નિંદક સ્ટ્રોંગ થઈ જાય અને તમે વીક

થઈ જાવ તો એ તમારા મંદ પુરુષાર્થને તીવ્ર પુરુષાર્થમાં પરિવર્તિત કરી શકે છે. તમારો સપોર્ટર બની શકે છે. પણ આપણને આપણી આસ-પાસ આપણા વખાણ કરે એવી વ્યક્તિઓ જ ગમે છે.

યાદ રાખજો, એવી વ્યક્તિઓ જમીનમાંથી ઉગેલા-ઝાડ જેવી હોય, એ પત્થરની શીલામાંથી પ્રગટેલા પીપળા જેવી ક્યારેય ન હોય.

માટીના ઝાડ તો વાવાઝોડું આવશે એટલે પડી જ જવાના છે. એમ જેમણે નિંદક વિના, માત્ર પ્રશંસકો સાથે જ જીવિત વ્યક્તિ કરી છે, તે ક્યારેય પોતાની ક્ષમતાને બહાર લાવી જ નથી શકતાં, તે હંમેશાં નબળા જ રહે છે.

તમે તમારી આસ-પાસમાં અનુકૂળ વ્યક્તિઓની જ ઈચ્છા રાખશો તો તમે ક્યારેય મહાવીર નહી બની શકો. તમે તમારી આસ-પાસ અનુકૂળતાને જ ઈચ્છશો તો તમે ક્યારેય શ્રેષ્ઠ નહી બની શકો.

પ્રતિકૂળતાની વચ્ચે પણ સમતા રાખી પુરુષાર્થ કરવો એ બહુ જરૂરી છે. કોઈ વ્યક્તિ ક્યારેય કોઈનું કાંઈ બગાડી શકે જ નહીં, બગાડી શકે તો તમારા સ્વયંના કર્મો !

માટે જ, ક્યારેય પુરુષાર્થમાં ક્યાસ ન રાખવો જોઈએ. સફળતા ન મળે તો નિરાશ ન થાવ, એને નિયતિ માનો. જે નિયતિનો સ્વીકાર કરે છે, તે ક્યારેય નિરાશ થતાં નથી.

પુરુષાર્થ પણ જરૂરી છે અને નિયતિ પણ જરૂરી છે. ફળની કોઈ આશા ન રાખવી, ફળ મળી જાય તો શ્રેષ્ઠ છે, ન મળે તો એ મારી નિયતિ છે.

તમારી અંદરમાં એનર્જીનો ધોધ વહેવો જોઈએ. પણ થાય છે શું ? તમારા મનમાં એટલાં બધાં વિચારો ચાલતાં હોય છે કે જે કરવા જેવું છે તે થતું નથી.

માનો કે, એક ભિખારી છે, તો ભિખારીપણું એ એની નિયતિ નથી. એ પુરુષાર્થ કરે તો એ કમાઈ શકે, પણ એના વિચારોમાં શું હોય ? મારાથી કાંઈ થાય નહીં, મને કોણ કામ આપે ? હું શું કરી શકું ? આ વિચારો એને નેગેટીવ બનાવી દે.

માટે જ મારી તમને એ જ પ્રેરણા છે કે, નથી ક્યારેય લાગણીના ભિખારી બનવું, નથી પ્રેમના ભિખારી બનવું, નથી ક્યારેય અનુકૂળતાના ભિખારી બનવું. અનુકૂળતા મળી જાય તો ઠીક છે, ન મળે તો અનુકૂળતાની ભીખ તો માંગવી જ નથી અને ક્યારેય પોતાની જાત પ્રત્યે નેગેટીવ ન થવું કે મારાથી આ ન થાય અને હું આ ન કરી શકું.

જે વ્યક્તિ ખોદવાની શરૂઆત કરે છે ત્યારે શરૂઆતમાં માટી જ નીકળે છે પણ જે પુરુષાર્થ ચાલુ રાખે છે, તે એક દિવસ અવશ્ય ખાણ સર્જીને સોનું મેળવે છે.

પુરુષાર્થનું પરિણામ :

એક બહેન હતાં એમને એક ભાઈ સાથે પ્રેમ થઈ ગયો. એમણે વાત કરી, પણ ભાઈ કહે, ના મારા કોઈ ભાવ નથી, મારે તમારી સાથે લગ્ન નથી કરવા. બેન રોજ પ્રયત્ન કરે, રોજ પોતાની ઈચ્છા વ્યક્ત કરે. એમાં ક્યારેક એ ભાઈ માત્ર ના પાડી દે તો ક્યારેક એમનો તિરસ્કાર કરી દે, ક્યારેક અપમાન પણ કરી દે કે રોજ ના પાડું છું છતાં રોજ કેમ એકની એક વાત કરો છો.

એમ કરતાં કરતાં 36 વર્ષ પસાર થઈ ગયાં. 36 વર્ષમાં બેને એના પુરુષાર્થમાં જરાપણ ક્યાશ આવવા ન દીધી. 36 વર્ષ પછી બન્યું એવું કે, એ ભાઈને પેરેલીસીસનો એટેક આવી ગયો. એ પથારીવશ થઈ ગયાં. એની આસ-પાસ એની સાથે કોઈ ન હતું.

ત્યારે પણ એ બેન, એ ભાઈ પાસે ગયાં અને કહ્યું, હું આજે પણ તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું, કેમકે, મેં તમને પ્રેમ કર્યો છે, તમારી સ્થિતિ કે સંપત્તિને નહીં. મેં તમને પ્રેમ કર્યો છે તમારા શરીરને નહીં. 36 માં વર્ષે એ ભાઈએ 'હા' પાડી.

શું થયું ? એ બેને એના પુરુષાર્થમાં કોઈ ક્યાશ રાખી હતી ?

35 વર્ષ સુધી એણે અફસોસ ન કર્યો પણ નિયતિનો સ્વીકાર કર્યો. જે પુરુષાર્થમાં ક્યાશ રાખે છે તે નિરાશ વ્યક્તિ હોય છે.

નિરાશ વ્યક્તિ હંમેશાં નિષ્ફળ થાય છે.

જિનશાસન એ નિરાશ કે નિરાશ વ્યક્તિનું શાસન નથી, એ તો નિયતિનો સ્વીકાર કરવાવાળાનું શાસન છે.

જો આ એક વાત સમજાય તો ગમે તે પરિસ્થિતિને તમે સ્વીકારી શકો, તમારામાં કોઈ વિકલ્પ જ ન આવે અને ગમે તેવી પરિસ્થિતિમાં તમે સાંગોપાંગ બહાર આવી શકો.

પુરુષાર્થના પ્રાજ્ઞાબિંદુઓ :

- પુરુષાર્થ કરવામાં ક્યાશ ન રાખવી અને સફળતા ન મળે તો નિયતિનો સ્વીકાર કરવો.
- તમારી ટીકા કરવાવાળા તમારી ક્ષમતાને બહાર લાવવાવાળા હોય છે.

- પોતાની જાત માટે જે નિરાશ રહે છે, તે ક્યારેય પ્રગતિ નથી કરી શકતાં.
- જે નિષ્ફળતા પછી પણ નિરાશ નથી થતાં તે અંતે સફળ થઈ જાય છે.
- લાઈફમાં જો તમે થાકી ગયાં, હારી ગયાં, નમાલા થઈ ગયાં, તો તમે પ્રભુના શાસનથી સેંકડો જોજન દૂર થઈ જશો.
- કાંઈપણ મળવું એ અંતે પુણ્યને આધીન જ છે, એટલે પુણ્ય ઘટે નહીં એવી પરિણતીઓ રાખવી, પુણ્ય ઘટે નહીં એવી પ્રવૃત્તિઓ કરવી, પુણ્ય ઘટે નહીં એવા ભાવ રાખવા.
- સતત શુભ ભાવમાં રહો, જેથી તમારો પુણ્યનો સ્ટોક વધ્યા કરે.
- પોતાની જાત માટે, પોતાની પરિસ્થિતિ માટે ક્યારેય નેગેટીવ ન થવું.
- હંમેશાં યાદ રાખો, સંસાર પુણ્ય અને પાપનો ખેલ છે.
- પુરુષાર્થ કરવો એ મારી ફરજ છે, ફળ મળવું એ નિયતિનો ખેલ છે.

We give IDENTITY to Product

RUSH IN TO THE WORLD OF EXCITING LABELS
SPECIALLY DESIGNED FOR YOUR PRODUCT

SCREEN LAND PRINT INDIA PVT LTD

No.51, Krishnappa Agraharam Street, (Near George Town Co-operative Bank) Kondlthope, Chennai - 600 079
TN, India Phone : +91-44-2520 9874 / 2596 / 6791, Email : info@screenland.in Web : www.screenland.in

Stickers & Holograms

www.screenland.in

Balwant G. Parekh 98200 65056

amish.p41@gmail.com

Amish B. Parekh 98200 52556

Shantinath Industries

Manufacturing : Lighting Luminaries

Labour Job : Powder Coating and Vitreous Enamelling

We are manufacturing for all leading Lighting Companies such as "Wipro Ltd., Bajaj Electricals Ltd., Crompton Greaves Ltd.,"

Unit II, B-2/2, Opp. Sanghavi Garden, Sagaoen M.I.D.C Phase Manpada Road, Dombivli (E), Dist. Thane - 421 204.

કાર્યક્ષમતા વધારવાની માસ્ટર કી - પોઝિટીવીટી



-કાશી, વારાણસી-10.01.2020

“ जाए सध्याए निकखंतो तमेव अणुपालिया ”

તમે હંમેશાં કાર્યની શરૂઆત જે શ્રદ્ધા ભાવથી કરો તે શ્રદ્ધાબળને ટકાવી રાખો. બની શકે સંયોગો કે પરિસ્થિતિ વિપરિત હોય, પ્રોબ્લેમ જોરદાર હોય પરંતુ શ્રદ્ધાબળ તમારી પોઝિટીવીટી બનીને તમને ટકાવી શકશે. પોઝિટીવીટી પ્રસન્નતા લાવે છે અને પ્રસન્નતા તમારી કાર્ય ક્ષમતા વધારે છે. કાર્યક્ષમતા વધવાથી કોઈ પણ સેવા, સાધનાનું કાર્ય કે અન્ય કોઈ પણ કાર્ય શ્રેષ્ઠ બનતું હોય છે. પ્રસન્નતાથી કરેલું કાર્ય વ્યક્તિ સારી રીતે સંપન્ન કરી શકે છે.

પોઝિટીવીટીની મધર વ્યક્તિ હોય કે ગુણો હોય ?

કોઈ પણ વ્યક્તિને પોઝિટીવીટીનું નિમિત્ત બનાવો તો બની શકે છે પરંતુ તે વ્યક્તિ સાથેના તમારા ઋણાનુબંધ, સંબંધ કે પછી તમારા પુણ્ય કે પાપ તમારી પોઝિટીવીટીને અસર કરશે અને માટે તમે દુઃખી થશો. વ્યક્તિ છદમસ્થ હોવાના કારણે કર્મધીન હોય છે, તેને કારણે તેનો

સ્વભાવ, પ્રકૃતિ, વ્યવહાર કર્મધીન હોય છે અને માટે જ વ્યક્તિ આધારિત સત્નિમિત્ત સર્જવાનો પ્રયત્ન પોઝિટીવીટીનો અપ-ડાઉન ગ્રાફ બનાવશે.

પોતાની સેલ્ફને વધુ એકટીવ, સ્ટ્રોંગ અને કાર્યરત રાખવા માટે પોઝિટીવ રહેવું પડે અને તેમાં ક્યારેક વ્યક્તિ નિમિત્ત રૂપમાં હોઈ શકે પણ તેવું કાયમ માટે ન હોવું જોઈએ.

ઉદાહરણ તરીકે પરમ ગુરુદેવ જ્યારે સંયમી સાધકોની વચ્ચે પ્રતિબોધ આપવા પધાર્યા ત્યારે ત્યાં રહેલા એક ભાઈને પ્રશંસાના બે શબ્દો કહ્યાં અને પાછળથી સર્વને બોધ આપતા કહ્યું કે, “તેની માટે પ્રશંસાના તે શબ્દો પોઝિટીવીટીનું એક સત્નિમિત્ત બની જશે પરંતુ માનો કે તે જ ભાઈને આવતીકાલે જો ઠપકો આપીશ તો ફરી એની માટે અસત્ નિમિત્ત બની જશે.” એટલે વ્યક્તિ આધારિત નિમિત્ત સર્જવાથી આપણી પોઝિટીવીટીનો ગ્રાફ બની જાય છે પરંતુ જે વ્યક્તિ સમજણ, જ્ઞાન, પ્રજ્ઞાને

પોઝિટીવીટીની મધર બનાવી દે છે, તેની પોઝિટીવીટીને કોઈ ક્યારેય બ્રેક નથી કરી શકતું.

તપસમ્રાટ પૂજ્ય ગુરુદેવ શ્રી રતિલાલજી મ.સા પરમ ગુરુદેવની પોઝિટીવીટીના નિમિત્ત છે, પરંતુ તેનાથી પણ વધારે તપસમ્રાટ પૂજ્ય ગુરુદેવની સાધના, પ્રજ્ઞા, તેમના ભાવો, તેમની સાથે વ્યતિત થયેલી ક્ષણો તે પરમ ગુરુદેવ માટે પોઝિટીવીટીનું વધારે નિમિત્ત બને છે કારણકે તે ગુણ આધારિત સત્નિમિત્ત છે. ગુણ સમજણથી અનુભવાય અને સમજણથી ગુણોની અનુભૂતિ કરી શકાય અને માટે જ ગુણ આધારિત પોઝિટીવીટીનું નિમિત્ત હોય તો તેનો ક્યારેય અપ-ડાઉન ગ્રાફ ન બને પરંતુ સદા વર્ધમાન પરિણામ રહે.

પોઝિટીવીટી જ્યારે સમજણમાંથી આવે ત્યારે સ્થિર હોય છે અને વ્યક્તિ આધારિત નિમિત્તમાંથી આવે ત્યારે અસ્થિર હોય છે.

પરમ ગુરુદેવ હિતશિક્ષા દ્વારા સર્વને આત્મબોધ આપી રહ્યાં હતાં, ત્યારે એક દશ્ય ભજવાઈ ગયું, એક પક્ષી જોરથી ઉડતું ઉડતું આવ્યું પણ તેને ત્યાં ગ્લાસ છે તે ખબર ન હતી એટલે તે ગ્લાસ સાથે ભટકાણું, ભટકાઈને પાછું ચાલ્યું ગયું, તે દશ્ય પરથી દષ્ટિબોધ આપતાં પરમ ગુરુદેવે ફરમાવ્યું તે પક્ષીને એમ જ હતું કે બધું કલીયર જ છે પણ કલીયર હોવા છતાં પણ બધું કલીયર નથી હોતું અને આવું જ કંઈ બને છે મિથ્યાત્વ મોહનીય અને સમક્તિ મોહનીયના દલિકોમાં ! મિથ્યાત્વ મોહનીયના દલિકો હંમેશાં માટે બ્લેક ગ્લાસ જેવા હોય છે જેથી સત્યની ખબર જ ન પડે, જ્યારે સમક્તિ મોહનીય ભ્રમ સર્જે છે. સમક્તિ મોહનીય કર્મ લાગે છે કલીયર

પણ તે કમ્પલીટલી કલીયર નથી હોતો માટે તે કર્મ પણ અન્ય કર્મબંધનું કારણ છે. આ સમજાવતા પરમ ગુરુદેવે કહ્યું, સ્ટડી કરાવતાં જો એક દશ્ય સામે આવે તો દશ્યમાંથી તરતજ તમારા થોકડા, શાસ્ત્રો અને પ્રભુના શ્રી વચન સાથે તે દશ્યનું કનેક્શન થવું જોઈએ, તો તેને જ્ઞાન કહેવાય, નહીં તો તમારી પાસે રહેલો સ્વાધ્યાય, થોકડા, ગાથા તે બધું માત્ર ઈન્ફરમેશન કહેવાય. ક્ષણે ક્ષણે તે ઈન્ફરમેશનને સમ્યક્જ્ઞાન, પ્રજ્ઞા રૂપે પરિણમવાનો પ્રયત્ન કરવો જોઈએ. જ્ઞાન આપણી અંદરમાં ઈન્ફરમેશન રૂપમાં જ હોય પણ તેનું પરિણમન પ્રજ્ઞા હોય છે. એટલા જ માટે પરમાત્માએ ‘જ્ઞ-પરિજ્ઞા’ એવો શબ્દ આપ્યો છે. જે જ્ઞાન એપ્લાયમાં આવી જાય તેને જ્ઞ-પરિજ્ઞા કહેવાય છે.



પોઝિટીવીટી સમજણ દ્વારા આવે, શાસ્ત્રોના પાના ના પાના ભણવા કરતાં પણ તમારી સમજણ આધારિત આવતી પોઝિટીવીટીમાંથી એક-એક લાઇનના દસ-બાર જ્ઞાન સૂત્રો બનાવવા જોઈએ જેથી તમારી વધતી પોઝિટીવીટી તમારી સાધનામાં બળ આપે અને સાધનાનું બળ તમને ઓછા સમયમાં વધારે સિધ્ધિ સુધી લઈ જઈ શકે.

ભગવાને ત્રણ પ્રકારના આગમ બતાવ્યા છે.

1. સૂત્રાગમ 2. અર્થાગમ 3. આત્માગમ.

1. સૂત્રાગમ-જ્ઞાનને અમલમાં મૂકવા ભગવાને સૂત્ર આપ્યાં છે. સૂત્રાગમ હંમેશાં પરિજ્ઞા બને છે.

2. અર્થાગમ- જ્ઞાનને સમજવા માટે ભગવાને અર્થ આપ્યા છે. અર્થાગમ હંમેશાં પ્રજ્ઞા બને છે. પ્રજ્ઞા તે ઈન્ફરમેશન છે અને પરિજ્ઞા તેનું સમ્યક્

આચરણ છે. પ્રજ્ઞા તમારી પાસે છે જેમકે, “ફેરફાર નહીં ત્યાં ફરિયાદ નહીં”, પણ જ્યારે કોઈ પરિસ્થિતિ ઉભી થાય તો તમારે આમ કરવું, આવી રીતે કરવું જોઈએ, તે પ્રજ્ઞા છે. પણ સમય પર જેટલું યાદ આવ્યું “ફેરફાર નહીં ત્યાં ફરિયાદ નહીં” તો એ તમારી માટે પોઝિટીવીટી વધારનાર સૂત્ર બની ગયું અને એવા સૂત્રોને તમારા આત્માગમ બનાવવા જોઈએ.

3. આત્માગમ-જે સૂત્રો, ભાવો તમારા આત્મસ્પર્શી બને, તમને વારંવાર અનુભવમાં આવી શકે, તેને ભગવાને આત્માગમ કહ્યું છે. જેમકે, કેટલાંક એમ કહે, ‘ઇટ્સ માય પુણ્ય’ તો તે તેનું આત્માગમ છે. તેના આધાર પર વ્યક્તિ પોતાની સેલ્ફને સમતામાં રાખે છે. જે સૂત્ર તમને આત્માના ગુણો સુધી લઈ જાય તે સૂત્ર તમારી માટે આત્માગમ હોય છે. સંસારી બોલતા હોય “જવા દે ને”, તો તે શબ્દો આવ્યા શેમાંથી ? તેની માટે આ શબ્દ કોઈ ને કોઈ રીતે વીતરાગતા પ્રગટાવવાનું આત્માગમ છે. “શું ફરક પડે” તેના આત્માને સમાધિ ભાવમાં રાખવા માટેનું આત્માગમ છે. તે બધું શાસ્ત્રાગમ ન પણ હોય પરંતુ આત્માગમ હોય, જેના આધાર પર સંસારી તેની સેલ્ફને તે પરિસ્થિતિ વખતે સમાધિમાં અને પોઝિટીવ રાખી શકતાં હોય.

જો તમારે પણ માનવભવને સફળ કરવો હોય, કોઈ પણ સિચ્યુએશનમાં પ્રસન્ન રહેવું હોય તો કોઈ પણ પરિસ્થિતિને પચાવવાની પીલ્સ તરીકે 2 સમાધિ સૂત્રો બનાવી ધ્યો, જેને કારણે તમે પણ તમારી સાધક દશાને સફળ કરી શકો.

યાદ રાખજો, જેની પાસે પોતાનું સમાધિ સૂત્ર આત્માગમમાંથી પ્રગટેલું હોય છે, તે વ્યક્તિ કોઈ પણ પરિસ્થિતિને પચાવી શકે છે અને એટલે

જ પોતાનું સમાધિ સૂત્ર બનાવવું તે પોતાની પોઝિટીવીટીનું મહત્વનું પરિબળ છે.

હંમેશાં યાદ રાખજો, વ્યક્તિનું નિમિત્ત તમને પોઝિટીવ પણ રાખી શકે અને નેગેટીવ પણ બનાવી શકે છે, પરંતુ સમજણનું નિમિત્ત તમને ક્યારેય નેગેટીવ ન બનાવી શકે કારણ કે, સમજણ ક્યારેય તમને દગો ન આપી શકે, સમજણ ક્યારેય બદલાઈ ન શકે, સમજણને કર્મોનો ઉદય ન હોય અને એટલા જ માટે વ્યક્તિને મહત્વ આપવું તે શ્રેષ્ઠ છે. પરંતુ વ્યક્તિત્વને મહત્વ આપવું તે સર્વ શ્રેષ્ઠ છે.

ગુરુને મહત્વ આપવું તે શ્રેષ્ઠ છે, પરંતુ ગુરુત્વને મહત્વ આપવું તે જ આત્મતત્વ છે.

એટલે જ વ્યક્તિ આધારિત સત્ત્વનિમિત્ત સર્જવા તે કદાચ બાલમંદિર છે પણ સમજણ આધારિત સત્ત્વનિમિત્ત સર્જવા તે પ્રભુની કોલેજ છે, માટે જ તમારી લાઈફને પોઝિટીવ રાખવા માટે તમારા જ સૂત્ર બનાવો.

જિજ્ઞાસુ દ્વારા પૂછાયેલા પ્રશ્નો :

1) ઓવર થીંકીંગને કારણે જ્યારે સમજણ ફેલ થઈ જાય ત્યારે શું કરવું ?

ગુરુદેવ : તે સમયે આવા નાના-નાના સૂત્રો આપણને ઓવર થીંકીંગ કરતા અટકાવી દે.

ચિંતન અને ઓવર થીંકીંગમાં ફરક છે. લાંબા સમય સુધી ચિંતન કરી સોલ્યુશન લાવે તે ચિંતન છે અને લાંબા સમય સુધી તે ઘટનાનું પોસ્ટ મોર્ટમ કરી કરીને પોતાની જાતને પીડિત કરવી તે ઓવર થીંકીંગ છે. કલ્પનાઓને નેગેટીવીટી તરફ લઈ જવી તે ઓવર થીંકીંગ છે અને કલ્પનાઓને પોઝિટીવીટી તરફ લઈ જવી તે ચિંતન છે.

સુત્તા અમુણી, મુણિણો સયા જાગરંતિ

પ્રભુના આ શ્રીવચન પર આત્મબોધ ફરમાવતા પરમ ગુરુદેવે ફરમાવ્યું, જેનો આત્મભાવ સૂઠ જાય છે તે અમુનિ છે અને જેનો આત્મભાવ જાગતો રહે એ જ મુનિ છે.

સંયમજીવનની ક્ષણોને વારંવાર ચેક કરશો તો રિયલાઈઝ થશે કે સંયોગોની અનુકૂળતા અને પ્રતિકૂળતામાં મોટાભાગે આપણી રાઈટ આઈડેન્ટીટી આત્મતત્ત્વ જાગૃતતા ભૂલાઈ જતી હોય છે. Right Identity સમજવાથી સત્યના માર્ગ પર ચાલવાનો અદમ્ય ભાવ જાગ્યો હતો, Right Identity ની ઓળખથી મિથ્યા અનુભૂતિ અને પ્રવૃત્તિમાંથી બહાર નીકળવાનો ભાવ જાગ્યો હતો, પરંતુ અનાદિકાળના અભ્યાસને કારણે ફરી પાછા એ જ ભાવોમાં, routine day to day ની life માં ફરી આપણી પરિણતિઓ દેહાધ્યાસમાં, દેહઅભ્યાસમાં, દેહાનુભૂતિમાં અને દેહઆત્મવત ભાવોમાં ભળી જતી હોય છે. વારંવાર ચિંતન કરતા રિયલાઈઝ થશે કે આત્મભાવ જાગતો હોય એવી ક્ષણો ઓછી હોય છે અને આત્મભાવ સૂઠ ગયો હોય એવી ક્ષણો વધારે છે. માટે જ, ચાહે જ્ઞાન આરાધનામાં હો કે દર્શન આરાધનામાં તમારી સેલ્ફને વારંવાર જગાડવી જોઈએ.

શ્રેષ્ઠ સંયોગોની ઉપેક્ષા

-કાશી, વારાણસી

11.01.2020

જગત જીવોનું દર્શન કરતાં રિયલાઈઝ થશે કે તે બધાં કરતાં તમે કેટલું શ્રેષ્ઠ પામ્યા છો, પરંતુ સ્વયંના પ્રમાદને કારણે જ્યારે શ્રેષ્ઠની ઉપેક્ષા તીવ્ર બની જાય છે ત્યારે આ શ્રેષ્ઠતાને ગુમાવવાનો વારો આવી જાય છે.

સામાન્ય પ્રમાદ નિઘત કર્મ બંધાવે છે, માટે કદાચ તે ક્ષમ્ય બની જાય. પરંતુ આખા દિવસમાં યાદ જ ન આવવું કે હું આત્મા છું, હું સંયમી છું, હું ત્યાગી છું, મેં દીક્ષામંત્ર લીધો છે, મેં પ્રભુનું શાસન સ્વીકાર્યું છે અને દૈનિક પ્રવૃત્તિ ગૌચરી, પાણી, વિહાર, આદિમાં જોડાયેલા રહેવું તે અંતે તો તીવ્ર ઉપેક્ષાનું કારણ છે અને તે નિકાચિત કર્મબંધનું કારણ બને છે. તે નિકાચિત કર્મોનો જ્યારે ઉદય થશે ત્યારે સમજવા છતાં પણ તમે તે કર્મજન્ય સંયોગોને દૂર નહીં કરી શકો.

આજની ઉપેક્ષાનો મોહોદય આવતી કાલની ઉપેક્ષાનો ઉદય કરાવશે અને આવતી કાલની ઉપેક્ષાનો ઉદય ફરી પાછો તીવ્ર બંધ કરાવશે. એટલે વિચારો, વર્તમાને મળેલા સંયમ જીવનની દરેક ક્ષણ કેટલી મહત્ત્વની છે. એ દરેક ક્ષણ જ તમારી અંદરમાં ઉદય, ક્ષયોપશમ અને નિર્જરાની સ્થિતિઓને સર્જીને તમારું ભવિષ્ય સર્જી રહી છે. એટલે પ્રમાદજન્ય મિથ્યા ભાવો આત્મઉપેક્ષા લાવે છે અને માટે જ તે ખૂબ અહિતકારક છે. આત્મઉપેક્ષા બંધ, ઉદય, ક્ષયોપશમ અને નિર્જરાના calculations થી આપણને ઉપેક્ષિત કરાવે છે. તે ઉપેક્ષાને કારણે બંધ, ઉદય ક્ષયોપશમ અને નિર્જરાજન્ય ફ્યુચર પ્લાનીંગ ઝીરો થઈ જાય છે.

પરમ ગુરુદેવ જ્યારે પણ કોઈ દશ્ય નિહાળે, ત્યારે તેના પર તેમનું ચિંતન શરૂ થઈ જાય. તે સમયે એક બિલાડી એક પ્રાણીને ખાવા જઈ રહી હતી, પરમ ગુરુદેવની વિચારધારા પ્રગટ થઈ, પ્રાણી તેની સામે રોતું હોય, ચૂં ચૂં કરતું હોય છતાં એને ભોગવવાની કઠોરતા એનામાં આવતી કેવી રીતે હશે? આ ચિંતનધારાના પ્રત્યુત્તર રૂપે સમજાવતા પરમ ગુરુદેવે જણાવ્યું, ગૌચરીનો આહાર વાપરતા વાપરતા કદાચ વાતોમાં લાગી જાવ એટલે તે સમયનો નિર્વેદ ભાવ તમારી અંદરમાં નથી આવતો અને તેને કારણે ભોજનની રસાસ્વાદજન્ય આસક્તિભાવ તમારી અંદરમાં પ્રગટ થાય છે અને તે સમયે મોહનીય કર્મનો ઉદય સફળ થઈ જાય છે. તે તમારી રસવૃત્તિને વધારનારો હોવાથી ફરી નવો બંધ કરાવે અને નવા બંધના સમયે ફરી પાછી રસવૃત્તિ જાગે, એ રસવૃત્તિના આધાર પર ફરી કર્મ બંધ થાય અને માટે જ ભયંકર હદનો મોહ જ્યારે રસવૃત્તિની તીવ્રતાને વધારી દે ત્યારે આપણી અંદરની કડૂણા કઠોરતામાં કનવર્ટ થઈ જતી હોય છે, તેને કારણે એ એકેન્દ્રિય જીવનો આહાર સહજ ભાવે અને ક્યારેક તો તે આનંદભાવે ખાઈ શકાય છે.

એ જ પ્રસન્નતા, ખુશી, રતિનો ભાવ જેને રતિ મોહનીય કર્મનો ઉદય કહેવાય, તે રતિ મોહનીય કર્મનો કેટલો તીવ્ર બંધ થતો હશે કે જેને કારણે સામેવાળો જીવ ભયંકર હદે વેદના અનુભવતો હોય છતાં પણ વ્યક્તિને ખાતી વખતે રતિનો અનુભવ થાય.

એટલે જીવનની દરેક ક્ષણોમાં સાવધાની હોવી જોઈએ. વારંવાર જો જ્ઞાનપ્રજ્ઞા પ્રગટ કરવામાં ન આવે તો આખો સમુદાય પણ તેવા જ પ્રકારની વૃત્તિઓનો શિકાર બની જાય અને એમાં પણ જો કોઈ જગાડનાર ન આવે તો તે ઉપેક્ષા દિવસો સુધી ચાલે. તે ઉપેક્ષા પ્રમાદજન્ય મિથ્યાભાવોમાંથી આવે છે અને તેનું ભવિષ્ય તમને ફરી પાછું હિંસક, શિકારી ભવોમાં લઈ જનારું બની શકે છે. માટે જ, વારંવાર એક સૂચન છે, જેવી રાઇટ આઇડેન્ટીટી ભૂલાય છે એટલે એક ભૂલ સો ભૂલો કરાવનારનું કારણ બની જાય છે અને એક ભૂલમાંથી આખું ભવિષ્ય ભયંકર હદે સર્જાઈ જાય છે. પછી તો વારંવાર મિથ્યાત્વમાંથી મિથ્યાત્વની વૃત્તિઓ વધતી જ જાય અને આખો સંસાર જે દષ્ટિએ જઈ રહ્યો છે, તે તો આપણે જોઈ જ રહ્યા છીએ.



જેમ જે જળમાં મેલ ધોવાની તાકાત હોય, તે જળમાં ગમે તેટલું મેલું વસ્ત્ર નાંખો, તો તે શુદ્ધ બની જાય, તેમ ગુરુ-પરમાત્માની વિરક્તિમાં એટલી તાકાત હોય છે કે તે શિષ્યના મોહનીય કર્મના મેલને ધોઈ તેને શુદ્ધ-વિશુદ્ધ બનાવી દે છે.



ઓ પ્રાજ્ઞપુરુષ મારા ગુરુદેવ !

મારી વાણી પર આપની જ્ઞાનવાણીનો અભિષેક કરી ધો !

જો મારી વાણી પર આપની વાણીનો અભિષેક થશે,

તો મારી વાણીમાં પણ આપના જેવી નમ્રતા અને મૃદુતા આવી જશે.

અને ગુરુદેવ ! આપ મને મળ્યાં છો, એનો હું પલ-પલ અહેસાસ કરી શકીશ.

ઓ પરમ ગુરુદેવ ! એવી કૃપા કરો... એવી કૃપા કરો...

37-37 આત્માઓને દીક્ષાના દાન આપી,

સ્વયંતા સંતત્વમાંથી અનેક સંતત્વ સર્જનારા...

અમારા પરમ ગુરુદેવ શ્રીના ચરણોમાં...

અમારી લાખ-લાખ શુભેચ્છા અભિવંદના !

- શ્રી રાજુભાઈ મેઘાણી

Rashmikant Desai - 93240 87750

E-mail : fineeyecare@gmail.com



FINE EYE CARE
Eye Consultants & Optical Gallery

COMPUTERISED EYE TESTING, QUALIFIED OPTOMETRIST,
CONTACT LENSES & LOW VISION CLINIC

Opp. Shankar Cinema , Tilak Nagar, Chembur, Mumbai - 400 089. Tel.: 2527 7444

Since-1954

Hardik Desai - 93210 29293



FINE FINE FINE & ALL FINE TO YOU

FINE VISION

Ophthalmic Optical Equipment & Lenses

384 - M, Dabholkar Wadi, Kalbadevi Road,
Mumbai - 2. Tel.: 2203 7444, 2205 7444, Fax : 2200 7444

Website : www.finevision.in/ E-mail : finevisn@vsnl.com

હૃદયભાવ

મારો
ભગવાન,
મને
બનાવે
ભગવાન

શાસન સર્જક !

આપનું શાસન અશમોભ છે.
અજોડ છે. અનુત્તર છે.
આપની પ્રવચન ધારા શ્રેષ્ઠ છે.
હૃદયસ્પર્શી છે, હૃદયવેધક છે.
આપનું શાસન પામી ધન્ય બન્યો,
આપની વાણીના શ્રવણે વૈરાગી બન્યો.
તારી આજ્ઞાને આરાધવા અશગાર બન્યો,

બસ હવે તો એક જ આશા છે,
તને પામીને તારા જેવું બનવું છે.
શું મારો ભગવાન,
મને ભગવાન નહીં બનાવે ?

પાવનધામ-કાંદિવલી:

પરમ ગુરુદેવના 50th જન્મોત્સવ નિમિત્તે 50 દિવસની એકાંત મૌન સાધનાની ભેટ અર્પણ કરી ધન્ય બન્યાં પૂજ્ય શ્રી સુબોધિકાબાઇ મહાસતીજી.

મુંબઇના પાવનધામ-કાંદિવલી ખાતે ગુરુણીમૈયા પૂજ્ય શ્રી વીરમતીબાઇ મહાસતીજી આદિ ઠાણાની નિશ્રામાં સ્થિરતા કરીને નિરંતર 50 દિવસ સુધી સંપૂર્ણપણે મૌન રહેવા સાથે એકાંત ધ્યાન સાધના પરિપૂર્ણ થતાં પૂજ્ય મહાસતીજીને વંદના-અભિવંદના અર્પણ કરવા

અનેક અનેક ભાવિકો અને શ્રી સંઘ શ્રેષ્ઠિવર્યો ઉપસ્થિત થયાં હતાં.

50 દિવસની સાધનાની અનુભૂતિની અભિવ્યક્તિ સાથે આ અવસરે પૂજ્ય શ્રી સુબોધિકાબાઇ મહાસતીજીએ પોતાની સાધનામાં સહાયક બનનાર આઠ ગુરુભગવંતો, રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ જેમણે આજ્ઞા આપી ઉપકાર કર્યાં, ગુરુણીમૈયા, સહવર્તી મહાસતીજીઓ, પાવનધામ સંઘના દરેક સભ્યો અને મદદરૂપ બનનારી નાની-મોટી દરેક વ્યક્તિ પ્રત્યે આભાર વ્યક્ત કર્યાં હતાં.

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવે વિડિયોના માધ્યમથી આ અવસરે પ્રેરણા આપી હતી કે, 'બોલવા જેવા સમયે મૌન નથી રહેવું અને મૌન રહેવા જેવા સમયે બોલવું નથી' બોલવાની ક્ષણોના અબોલા ઘાતક-વિઘાતક બની જતાં હોય છે. મૌન અને બોલવાનો આ વિવેક કરતાં આપણે શીખી જઇએ. જે મૌનની સાધના મારા મહાવીરને ગમતી હતી, જે મૌનની સાધના મારા તપસમ્રાટને ગમતી હતી એવી શ્રેષ્ઠ સાધના કરનાર સાધ્વીજીને આપણે ભાવવંદન કરીએ.

ગોંડલ:

શ્રી સંઘાણી સ્થાનકવાસી જૈન સંઘ-ગોંડલમાં પૂ. શ્રી નૂતન-જય-વિજય મ. ની પુણ્યતિથિ ઉપલક્ષે ઉજવ્યો “ગુરુ ગુણ ગુણોત્સવ.”

મહામંત્ર આરાધક પૂ. શ્રી જગદીશમુનિ મ.સા.ની તૃતીય પુણ્યતિથિ, પૂ. શ્રી જયાબાઇ મ. ની 20 મી પુણ્યતિથિ અને પૂ. શ્રી વિજયાબાઇ મ. (મૌં સ્વામી)ની 2જી પુણ્યતિથિ અવસરે પાંચ દિવસની તપ આરાધના થયેલ.

આ મહોત્સવમાં સ્વામીને જે ગમતું હતું તે ‘જીવદયા શૈક્ષણિક સહાય’ તેમ જ ‘સ્વરોજગાર યોજના’ દ્વારા શ્રી બીનાબેન અજયભાઇ શેઠ (સાયન, મુંબઇ) એ ગોંડલના તમામ જૈનોને લાભ લેવા જણાવી, સ્વયંએ પોતાના જીવનમાં બેસ્ટ ઇન્વેસ્ટ (ગુરુભક્તિ) દ્વારા રીયલ પ્રોફિટ (ગુરુરાજીપો) પ્રાપ્ત કર્યો, તે ધન્ય છે.

પુણ્યતિથિ અવસરે પધારતા પૂ. શ્રી ગજેન્દ્રમુનિ મ.સા., પૂ. શ્રી પારસમુનિ મ.સા., પૂ. શ્રી ધર્મોલાબાઇ મ., પૂ. શ્રી સ્મિતાબાઇ મ. સર્વએ ગુરુ પ્રત્યેના પોતાના અહોભાવ વ્યક્ત કર્યા તેમ જ રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબે દિવ્ય સંદેશ દ્વારા સર્વ ભાવિકોને ગુરુભક્તિના ભાવમાં ભિંજવી દીધા. આ અવસરને શોભાયમાન બનાવવા સંયમ વરિષ્ઠા પૂ. શ્રી ઉષાબાઇ મ., પૂ. શ્રી જ્યોત્સનાબાઇ મ., પૂ. શ્રી ચંદ્રિકાબાઇ મ., પૂ. શ્રી મંજુલાબાઇ મ., પૂ. શ્રી ઉર્મિલાબાઇ મ., પૂ. શ્રી રાજુલબાઇ મ., પૂ. શ્રી રાજેશ્વરીબાઇ મ., પૂ. શ્રી વર્ષાબાઇ મ., પૂ. શ્રી આરતીબાઇ મ., પૂ. શ્રી નંદાબાઇ મ., પૂ. શ્રી હીનાબાઇ મ. આદી સતીવૃન્દ પધારી, ગુરુભક્તિ કરી પાવન થયા.

શ્રી પ્રવિણભાઇ કોઠારી, શ્રી અશોકભાઇ કોઠારી, શ્રી રાજવી જ્યોતિમય બાપુ તથા શ્રી

અજયભાઇ શેઠ આદિ ઉપસ્થિત રહેલ. આ અવસરે પૂ. શ્રી કિરણબાઇ મ. લેખીત પુસ્તકનું વિમોચન થયેલ તથા જેમને પોતાના જીવનમાં સેવાનો ભેજ ધારણ કરેલ તેવા શ્રી મુકુંદભાઇ પારેખ તથા શ્રી ચિમનભાઇ દેસાઇની સેવાને સન્માન કરી બિરદાવ્યા હતાં.

આ સમસ્ત અવસરને દિપાવનાર પૂ. શ્રી હીનાબાઇ મ. નો પુરુષાર્થ વંદનીય છે. આ અવસરે પૂ. શ્રી જયા-વિજયાબાઇ મ. મોટા સ્વામીનું શતાબ્દી વર્ષ ચાલુ થયેલ છે. તે અવસરે શ્રી સંઘાણી સંઘના કર્મચારીને પૂ. શ્રી હીનાબાઇ મ.ની પ્રેરણાથી રૂા. 22,501 આપી સેવાનું બહુમાન કરેલ. પુણ્યતિથિ મહોત્સવને શોભાયમાન બનાવવા પ્રમુખ શ્રી અશોકભાઇ કોઠારીની જહેમત પ્રશંસનીય હતી.

શ્રી પ્રતિક્ષાબેન સંઘાણી એ એન્કેરીંગ કરી પોતાની ગુરુભક્તિ દિપાવી.

પેટરબાર જગ-જયંત તીર્થધામનું ઉદ્ઘાટન:

પેટરબાર ઝારખંડના આંગણે પરમ દાર્શનિક ગોંડલ ગચ્છ શિરોમણી પૂજ્ય શ્રી જયંતમુનિ મહારાજ સાહેબના સ્મૃતિ મંદિરનો ઉદ્ઘાટન સમારોહ રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ, પૂજ્ય શ્રી પંચકમુનિ મહારાજ સાહેબ, પૂજ્ય શ્રી સોહમમુનિ મહારાજ સાહેબ, પૂજ્ય શ્રીદર્શનાજી મહાસતીજી આદિના સાંનિધ્યે પૂર્વ ભારતના અનેક સંઘોની ઉપસ્થિતિમાં ધર્મવત્સલા કાજલબેન કિરણબાઈ બાટવીયાના હસ્તે રજત ચાવીથી સ્મૃતિમંદિર ઉદ્ઘાટન થયા બાદ શ્રી પલ્લવીબેન વિનુભાઈ મહેતાના હસ્તે સ્મૃતિ પ્રતિક અર્પણ કરીને જયંત ગુરુવરના જયજયકાર સાથે સંપન્ન થયેલ.

આ અવસરે ચાસ, વર્ધમાન, ઝરીયા, બોકારો, ધનબાદ, ટાટાનગર, કોલકાતા, બિલાસપુર, કત્રાશ આદિ અનેક સંઘો ઉપસ્થિત રહેલ.

માતુશ્રી તારાબેન મોદી પરિવારની સાધર્મિક ભકિત અને શ્રી મધુભાઈ ગાંઠાણીના ભંડારામાં 12,000 લોકોનો જમણવાર થયેલ.

માતુશ્રી અમૃતબેન ભગવાનજી અવલાણી પરિવાર તરફથી ઝરીયા અને કત્રાશ ઉપાશ્રયના નુતનીકરણ લાભ લેવાતા હર્ષ-હર્ષ નાદ છવાયેલ.

ઉપરાંતમાં, આ અવસરે બનારસના બ્રાહ્મણ પરિવારના શ્રી વાયસ્પતિજી મિશ્ર

જેમણે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ આદિ 41 સંત-સતીજીઓની બનારસની સ્થિરતા દરમ્યાન કરેલી સેવા-વૈયાવચ્ચ તેમ જ સ્વયંના નિવાસસ્થાન 'વૈદિકવિલા'ને પારસધામનું નામ આપીને અર્પણ કરવાની એમની ઉદારભાવનાનું ગૌરવવંતી પાઘડી, શાલ અને સ્મૃતિપ્રતીક સાથે સન્માન કરવામાં આવ્યું હતું.



શ્રી પેટરબાર સંઘના નિયુક્ત કરવામાં આવેલાં નવા કમિટી મેમ્બર્સ



બનારસના શ્રી વાયસ્પતિજી મિશ્રાજીને સન્માનિત કરતા શ્રી પ્રવીણભાઈ પારેખ, શ્રી દિલેશભાઈ ભાયાણી



શ્રી બાટવીયા પરિવારનું સન્માન કરતા શ્રી વીનુભાઈ શાહ, શ્રી પ્રવીણભાઈ પારેખ

વ્યક્તિ પાસે 'સ્વ' સિવાયનું જે કાંઈ પણ હોય છે તે ગતિ કરવાવાળું હોય છે.

શ્રી ગુણવંતભાઈ બરવાળીયાને એવોર્ડ અર્પણ:

આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વિજ્ઞાન અને અધ્યાત્મને જોડવા સતત પ્રયત્નશીલ ઈન્સ્ટીટ્યુટ ઓફ જૈનોલોજી યુ.કે. અને ભારત દ્વારા ગુજરાત વિશ્વકોશ ભવનમાં અમદાવાદમાં એવોર્ડ વિતરણ સમારંભ યોજાયો.

ચંદ્રયાન મિશનના પ્રથમ હરોળના વિજ્ઞાની શ્રી નરેન્દ્રભાઈ ભંડારી (અમદાવાદ) અને અનેક ગ્રંથોના રચયિતા, સંપાદક અને દાર્શનિક સાહિત્યના અભ્યાસુ શ્રી ગુણવંતભાઈ બરવાળીયા (મુંબઈ)ને તેમના ક્ષેત્રોની વિશિષ્ટ કામગીરી બદલ લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવેલ.

પદ્મશ્રી બાલકૃષ્ણભાઈ દોશી (વિશ્વના

નામાંકિત આર્કિટેક), શ્રી ગણપતરાય ચૌધરી (ઉદ્યોગપિત અને જીતોના ચેરમેન), પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ (આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત સાહિત્યકાર અને વક્તા), શ્રી શ્રેયકભાઈ શેઠ (અમદાવાદના જૈન અગ્રણી શ્રેષ્ઠીવર્ય) અને

ડૉ. શ્રી વિનોદભાઈ કપાસી (મહાવીર ફાઉન્ડેશન ઈંગ્લેન્ડના ચેરમેન)ના હાથે શાલ, પુસ્તક, સન્માનપત્ર અને એવોર્ડ અર્પણ કરવામાં આવેલ.

આ પ્રસંગે અનેક જૈન અગ્રણીઓ અને વિદ્વાનોની ઉપસ્થિતિ હતી.



લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડનું ગૌરવ સ્વીકારતાં શ્રી ગુણવંતભાઈ બરવાળીયા

તમે સાધક છો કે સિધ્ધ સાધક ?

સામેવાળાની ઓરાને શુધ્ધ કરવાની ક્ષમતા જો તમારામાં આવી જાય તો તમે સિધ્ધ સાધક છો, અન્યથા સામાન્ય સાધક છો.

જેમ લાઈટની સ્વીચ ઓન કરો એટલે અંધારાને કહેવું ન પડે કે તારે હવે વિદાય લેવાની છે, એની વિદાય થઈ જ જાય, એમ જે સિધ્ધ સાધક હોય એના મુખમાંથી જ્યારે એકવાર મંત્રનો ધ્વનિ નીકળે એટલે એની આસ-પાસ જેટલાં પણ નેગેટિવ તત્ત્વો હોય, અશુભ તત્ત્વો હોય તે ઑટોમેટિક વિદાય લઈ લે, દૂર થઈ જાય.

પ્રભુ સ્મરણમાં, પ્રભુમંત્રમાં એવી દિવ્ય શક્તિ છે, એવી અદ્ભૂત ક્ષમતા છે, જે તમને શુધ્ધ કરે અને સામેવાળાને સ્વસ્થ કરે, જે તમને સ્વસ્થ કરે અને સામેવાળાને શુધ્ધ કરે.

સિધ્ધ સાધકને એ દિવ્ય શક્તિના મૂલ્યની જાણ હોય, એ દિવ્ય શક્તિનો અનુભવ હોય.



સાધક કે સિધ્ધ સાધક ?

સિધ્ધ સાધક ક્યારેય સ્વાર્થી ન હોય, તે પરમાર્થી હોય. જેને માત્ર 'સ્વ' દેખાય અને સર્વ ન દેખાય, તે સ્વાર્થી હોય. જેને 'સ્વ' પણ દેખાય અને સર્વ પણ દેખાય, તે પરમાર્થી હોય.

સિધ્ધ સાધક એ જ હોય જેને પોતાને જે પ્રાપ્ત થયું છે તે પમાડતાં આવડે.

જેને પમાડતાં આવડે, તે પરમાર્થી !

જેને પોતાની પાસે રાખતાં આવડે, તે સ્વાર્થી !

સ્વાર્થનો ધર્મ તો ઘણીવાર કર્યો, હવે પરમાર્થનો ધર્મ કરવાની શરૂઆત કરવાની છે.

જે પામ્યા છો, તે પમાડવા માટે શું જોઈએ ?

જે પામ્યા છો, તે પમાડવા માટે માત્ર ભાવ જોઈએ.

'આત્મ દ્રવ્યથી દરેક આત્મા સમાન છે, દરેકની ક્ષમતા સમાન છે. જે ક્ષમતા મારા પ્રભુ મહાવીરમાં, તે ક્ષમતા મારામાં અને તે જ ક્ષમતા સર્વ આત્મામાં !'

બસ, આ ભાવ સ્વયંમાં પ્રગટાવવાનો અને સામેવાળાના હૃદયમાં પણ પ્રગટાવવાનો છે.

તમે સાધક બનો એ તમારો સ્વાર્થ અને તમને જોઈને તમારી વાણી અને વ્યવહાર જોઈને અન્યને સાધક બનવાનું મન થાય તે પરમાર્થ !

એક સાધક જ્યારે સર્વને પમાડવાના ભાવ સાથે સાધના કરે છે, ત્યારે સિધ્ધિ પ્રાપ્ત થાય છે.



શ્રી જયભાઈ દિલીપભાઈ રાંભિયાની પ્રાર્થનાસભા બની પરમાર્થની સભા

સી.એ.ની ઉચ્ચ કક્ષાની ડીગ્રી ધરાવતાં મુલુંડના કચ્છી પરિવારના માત્ર 28 વર્ષના નવયુવક શ્રી જયભાઈ દિલીપભાઈ રાંભિયા ની વિદાય થતાં તેની પ્રાર્થનાસભા સમગ્ર જૈન સમાજ માટે પરમાર્થનો એક ઇતિહાસ રચી ગઇ હતી.

મુલુંડના કાલિદાસ હોલ ખાતે આયોજિત શ્રી જયભાઈની પ્રાર્થનાસભા અનેક રીતે અવિસ્મરણીય બની હતી. શોકગ્રસ્ત શ્રી રાંભિયા પરિવારને સાંત્વના આપવા અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ આચાર્ય પૂજ્ય શ્રી ભાવચંદ્રજી સ્વામી અને વિશાળ સંખ્યામાં સંત-સતીજીઓ અને માનવ મહેરામણની ઉપસ્થિતિ સાથે વિશેષરૂપે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવશ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ દ્વારા વિડીયોના માધ્યમે ભાવાંજલિ આપવામાં આવી હતી.

આ પ્રાર્થનાસભા સમગ્ર જૈન સમાજને પરમાર્થનું એક નવું દિશા ચિહ્ન આપી ગઇ હતી જ્યારે, શ્રી જયભાઈના સ્મરણાર્થે ગરીબ-જરૂરિયાતમંદ એવા કેન્સરપીડિત દર્દીઓ માટે રાહત ફંડ ઊભું કરવાની જાહેરાત થતાં જ શ્રી પરાગભાઈ શાહના રૂ. 55,55,555 ના અનુદાન સાથે આરતી ઇન્ડસ્ટ્રીઝના શ્રી ચંદ્રકાંતભાઈ અને શ્રી રાજેન્દ્રભાઈ ગોગરી તરફથી રૂ. 55,55,555 ના અનુદાનની ઘોષણા કરવામાં આવી હતી. આ બહોળા અનુદાનમાં જોડાવા ઉપસ્થિત અનેક અનેક ભાવિકોએ ઉદાર ભાવે અનુદાન અર્પણ કરતાં વધુમાં 1 કરોડ રૂપિયાથી વધારે રકમ એકત્રિત થઇ હતી. હજી પણ આ કાર્ય માટે ભાવિકો તરફથી અનુદાનનો પ્રવાહ આવી રહ્યો છે. એકત્રિત થયેલી આ અનુદાનની સમગ્ર રકમનો ઉપયોગ જરૂરિયાતમંદ કેન્સરપીડિત દર્દીઓ અર્થે કરવામાં આવશે.

શ્રી દિલીપભાઈ રાંભિયાની મુલુંડ સંઘ-મહાસંઘમાં દાયકાઓની વૈયાવચ્ચ સેવા અનન્ય છે.

परमपूज्य गुरुदेव श्री नम्रमुनि महाराज साहेबना चरणो मां कोटी कोटी वंदन

India's Leading Green Fuel Crusader

CONFIDENCE GROUP

P R E S E N T S



India's First
**Blast Proof &
Light Weight**
Composite LPG Cylinder

अब भारत का हर किचन होगा ब्लास्ट प्रूफ

Group Infrastructure :

- Single Largest Cylinder Manufacturer in Asia.
- One of India's Fastest Growing LPG Company.
- 196 Auto LPG Stations across India.
- Own Fleet of LPG Tankers.
- 58 LPG Bottling Plant across India.
- A Leading Player in LPG Retailing for Household, Automobile, Industrial & Commercial Purpose.
- BSE Listed Company.

Call : 7620 250 251

website : www.confidencegroup.co

■ Nitin Khara ■ Nalin Khara ■ Ilesh Khara



Confidence Petroleum India Limited

Head Office : 4th Floor, Landmark, Above Big Bazaar, Wardha Road, Nagpur - 440012

www.elitegogas.com

■ gogas@confidencegroup.co ■ info@elitegogas.com ■ elitegogas

जैन इति

इस्युआरी 2020 31



રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના 50th જન્મોત્સવ અવસરે

અર્હમ યુવા સેવા ગ્રુપ (AYSG) દ્વારા આરંભિત

॥ પરમ પ્રયાસ ॥



5000+ વ્યક્તિઓ

Sept 2019 : Mega Blood donation camp

365 દિવસની નિઃસ્વાર્થ સેવા

વર્ષભરની

12 Mega Activities દ્વારા

માનવતાના આ પ્રસારણમાં

'પરમ પ્રયાસ'ના પ્રારંભિક તબક્કે

5 Mega Activities



7000+ beneficiaries

Dec 2019: Mega Blanket Distribution.



6000+ kgs

Oct 2019 : Gift Mithai Spread Mithaas

PASTI SE PUSTAK
શિક્ષણ એ જ ભવિષ્યનો પાસપોર્ટ છે

Target 2,50,000 kgs



Target 50 Workshops

Nov 2019: Arham Prayaas Workshop



Jan 2020: Pasti se Pustak

Contact : 7666708869 For Online Donations: www.arham.org | Email: support@arham.org | [/AYSGIndia](https://www.facebook.com/AYSGIndia)